

વિડુંગા

વર્ષ-૨, અંક-૧
જાન્યુઆરી - માર્ચ, ૨૦૦૮


પક્ષીનિરીક્ષકો વચ્ચેનો સેતુ



શિશીર ૨૦૦૮

પદ્ધતિવિજ્ઞાની શ્રી સલીમ અલી

લાલસિંહ રાઓલ



સને ૧૯૪૮ના અંત અને '૪૮ની શરૂમાં મને પક્ષીનિરીક્ષણનો શોખ લાગ્યો. શ્રી હરિનારાયણ આચાર્ય ૧૯૩૪થી ઉદ્દા ગાળામાં 'કુમાર' માસિકમાં 'વનવગડાના વાસી' નામની લેખમાળા આપેલી. આપણી આસપાસ જોવા મળતાં થોડાં પંખીઓનો પરિચય શ્રી આચાર્ય અત્યંત પ્રાસાદિક ભાષામાં તેમાં આપેલો. જ્યાં જ્યાંથી મજ્યા ત્યાં ત્યાંથી 'કુમાર'ના તે જૂના અંકો મેળવી તે લેખમાળાના કેટલાય હમા મેં વાંચ્યા. શ્રી વિજયગુમ મૌર્ય લખેલ પુસ્તક 'પ્રકૃતિનાં લાડકવાયાં પંખીઓ' સસ્તા સાહિત્યે તે અરસામાં પ્રસિદ્ધ કરેલું. તેની મદદથી આપણી આસપાસનાં પંખીઓનું નિરીક્ષણ હું કરવા લાગ્યો. આમ બે-ગ્રામ વરસ નીકળી ગયા. શ્રી સલીમ અલીએ લખેલ અંગ્રેજ પુસ્તક The Book of Indian Birds ત્યાર બાદ મારા હાથમાં આવ્યું. ભૂખ્યાને મનગમતું મિષ્ટાન મળી ગયા જેવું થયું. બહુ રસપૂર્વક તે વાંચી ગયો. ૧૯૫૧ આસપાસની તે આવૃત્તિમાં દરેક પાના ઉપર એક જ પંખીનો પરિચય અને આમે પાને તેનું રંગન ચિત્ર. પંખીની જીવનચર્યાનું વર્ણન એવું રસાળ કે તેનું બુબહુ ચિત્ર આપણી આંખ આગળ ખડું થાય. તેમના અંગ્રેજ ભાષા પરના પ્રભુત્વનું તો શું કહેવું? તે વર્જનો વાંચવા એ એક લહાવો હતો. પછીની આવૃત્તિઓમાં દરેક પૃષ્ઠ પર એકને બદલે બે પંખીઓનો પરિચય આપવાનું રાખ્યું. પરિણામે લખાજી ટૂંકાવંસું પડ્યું. પહેલાંના વર્જનનમાં જે મોહકતા હતી તે ઘટી.

મારો પંખીશોખ જેમ જેમ વિકસતો ગયો તેમ તેમ શ્રી હરિનારાયણ આચાર્ય અને શ્રી સલીમ અલીને મળવાની ઉત્કર્ષ વધવા લાગી. બનતા સુધી ૧૯૬૬માં શ્રી આચાર્યને પહેલી વાર તેમના ઘરે અમદાવાદમાં હું મળ્યો. શ્રી આચાર્ય એટલે પ્રકૃતિવિજ્ઞાના ધૂર્ણર જ્ઞાતા. તેની વિવિધ શાખાનું વ્યવસ્થિત બેદાણ કરનાર ગુજરાતી ભાષાના પહેલા લેખક. બેએક કલાક તેમની સાથે વાતો થઈ. અંતર બહુ પ્રસન્ન થઈ ગયું.

હું રહું સૌરાષ્ટ્રમાં, શ્રી સલીમઅલી રહે મુંબઈમાં. તેમને મળવાની તક મળશે કે કેમ, મળશે તો ક્યારે મળશે તેની કોઈ શક્યતા દેખાતી ન હતી. પણ મારું નસીબ જેર કરતું હતું. અચાનક તે તક આવી પહોંચી. ૧૯૭૦ના ઓગસ્ટમાં તે વખતના જસદણના યુવરાજસાહેબ શ્રી શિવરાજકુમાર ખાચરનો પોરબંદર મારા ઉપર પત્ર આવ્યો. "સલીમ અલી ઓગસ્ટમાં થોડા દિવસ માટે હિંગોળગઢ આવે છે. તમે તે વખતે ત્યાં આવો. વરસોની મારી ઝંખના આમ ફળીભૂત થશે તે જાણી મારા આનંદનો

પાર ન રહ્યો. નિશ્ચેત દિવસે હું પોરબંદરથી હિંગોળગઢ પહોંચ્યો. શ્રી સલીમ અલી તેમજ શ્રી યુવરાજ સાહેબ સાથે ગ્રાનેક દિવસ ઘોરડ (Great Indian Bustard)-ની તપાસમાં તેના જૂના વસવાટ વિસ્તારમાં ફ્યો. પણ ઘોરડ ત્યાંથી નામશેષ થઈ ગયેલાં એટલે ન મળ્યાં. પછીના ચાર દિવસ સતત જેરદાર વરસાદને કારણે બહાર નીકળી શકાયું નહીં. હિંગોળગઢમાં શ્રી સલીમ અલીની બાજુના જ રૂમમાં મારો ઉતારો હતો. તે ચાર દિવસ તેમની સાથે નિકટતાથી ગાયા.

તેમનામાં મોટાઈનું નામ ન મળે. પક્ષીવિજ્ઞાનમાં તેમની આગળ હું તો સાવ બાળક જેવો ગણાઉં, પણ એ મહાન પક્ષીવિજ્ઞાની બહુ સહજતાથી મારી સાથે વાતો કરતા. પ્રમાણમાં ઓછી ઊંચાઈ, ઊજળો વાન, એકવાર્યો બાંધો, આંખે ચશ્મા, માથે કાબરા વાળ અને તેવી જ કાબરી નાની દાઢી. આ થયું શ્રી સલીમ અલીના દેખાવનું વર્ણન. મારે પ્રથમ મુલાકાત થઈ ત્યારે તેમની ઉમર ૭૨-૭૩ વરસની. તંદુરસ્તી સારી. સ્ફૂર્તિ તો યુવાનને શરમાવે તેવી. સ્વસ્થ ટડ્કાર ચાલ. નિયમિત જીવનચર્યા. નિર્બસની જીવન. કાયમ વહેલા ઉઠવાની ટેવ. વાણી અને વર્તનમાં સરળ. મોટાઈનું નામ નહીં. પોતા વિશે ઓછું બોલે. બીજાની વાત ધ્યાનથી સાંભળે. સ્વભાવે રમુશ. પ્રથમ પરિચયે જ મારા મન ઉપર પડેલ આ તેમની છાપ. પછી તો અનેક વાર તેમના સંપર્કમાં આવવાનું સહ્યાય મને મળ્યું અને પ્રથમ વખતે મારા મન ઉપર પડેલી તેમની છાપ વધારે ને વધારે વિશેદ બનતી ગઈ.

પંખીઓના અવલોકન અને અભ્યાસ માટે શ્રી સલીમ અલી જીવનભર ભારતના ખૂણો ખૂણે કરતા રહ્યાં. કન્યાકુમારીથી લેહ-લડાખ અને ઓખામંડળથી અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર તેઓ ખૂંઢી વણ્યા. આવાં ભ્રમણોના પરિપાકરૂપે આપણને તેમની પાસેથી મળ્યા. 'The Book of Indian Birds', 'Birds of Kutch', 'Birds of Kerala', 'Birds of Sikkim', 'Indian Hill-Birds'. આ ઉપરાંત, 'બોંને નેચરલ લિસ્ટરી સોસાયટી' (B.N.H.S.) ના જર્નલમાં પક્ષીઓના અભ્યાસ અર્થે કેરલાં ભ્રમણોના વૃત્તાંત અને કેટલાય લેખો. કોઈ પણ પક્ષીવિજ્ઞાની માટે આટલા ત્રણોનું કર્તૃત્વ ગૌરવરૂપ ગણાય. (કમશઃ)

શ્રી-૨, હરિઓમ એપાર્ટ., 'ટાઈસ ઓફ ઇન્ડિયા' મેસ રેઝ, જીવરાજ પાર્ક, અમદાવાદ-૫૭

સૂચિ




પદ્ધતિકાળી કાર્યાગ્રમ અલ્લા	૨
લિંગાવલોડન	૪
નિર્દેશકાણ નોંધ	૫
ગાય પર જાપતો	૧૫
ઉત્તર ગુજરાતનાં જગાશાયો-૨	૧૬
કષ્ણમાં ભરકતી લટોઝો	૧૮
મ.કુ.હિંમતક્રિએલની ડલાને	૨૧

મુખ્યપૃષ્ઠ :

ભરકતી લટોઝો (Hypocolius)
તસવીર : કે.કે.તિવારી, મોરી વિચારી, કર્ણ
આ અંકમાં રજૂ થતા વિચારો સાથે સંપાદક મંડળ
સહમત હોય તે જરૂરી નથી.

સંપાદકીય



'હમણાં ચકલીઓ ઓછી થઈ ગઈ છે!' એ ઉદ્ગાર હવે ખૂબ જનસામાન્ય થઈ ગયો છે. ગયા મહિને મારે હેઠાબાદ જવાનું થયું ત્યારે ત્યાં પણ એક ગુજરાતી મહાનુભાવે મારા રસ્નો વિષય જાણી આપિત્તું બક્ત કરી દીધો.

મારા ઘરના આંગણામાંથી હજુ સુધી તો તે લુમ નથી થઈ પણ બસ એટલું જ.. બે-ન્યાશ કે કદાચ થોડીક વધારે, દાશા ચણવા આવી જાય. પણ તેમની 'ચી... ચી... નું સતત સંભળાતું સંગીત નથી કે નથી માળા બનાવવાની ગતિવિધિ દરમિયાન પડતો કચરો. કશુંક ખૂબ ગંભીર બની રહ્યું છે તેમની આ ચુપકીદી પાછળ!

'ચકલી'એ તો આપણને કેટલો સાથ-સંગાથ આયો! ઠે.. ઠીટ પથરનાં ખોખાં ખડકી દીધાં ત્યાં સુધી. અરે આપણું જોઈને - ના કદાચ આપણો સહવાસ ન ત્યજવા તેણે આપણાં જ ઘરમાં રહેવાનું શરૂ કરી દીધું. જુઓને, એનું સામાન્ય અંગેજ નામ પણ 'House Sparrow' પડી ગયું. બસ એક પરિવારના સભ્યની જેમ આપણા જીવનમાં વણાઈ ગઈ - ઓટોપોત થઈ ગઈ. અને એ 'ચકલી' પણ અદ્દય થઈ જશે?! જે માત્ર શહેર - શેરીમાં જ મળે અને વનવગડામાં તો ભાગ્યે જ.. એ 'ચકલી' પણ..??

ખૂબ જ અનુદૂલિત પ્રજાતિનું લુમ થવું સમજ શકાય પણ ચકલીએ તો કશો જાતીય લેદબાવ રાખ્યા વિના માનવજાતની ઉત્કાંત અને વિકાસના સાક્ષી બનીને આપણી સાથે આત્મીયજનની જેમ સહપ્રવાસ કર્યો.. પર્યાવરણનાં સર્વે વિધાતક પરિબળોને સાધી લીધા અને પ્રયેક કસ્ટોટીને પાર કરી. પણ હવે તે થાકી ગઈ કે હારી ગઈ! કદાચ તેની દિશાચૂક થઈ છે. સીમ ભણી જવાને બદલે ગામ ભણી આવી ગઈ!

અને એક વસ્તુ નિશ્ચિત છે; 'ચકલી'ની સમસ્યા ભૌગોલિક અભયારણ્યોથી દૂર નથી થવાની. જંતુનાશકો અને રાસાયનિક ખાતરોનો વધી રહેલો વ્યાપક વપરાશ, વધી વસતી તથા વધી રહેલાં વાહનો અને પ્રેટોલિયમ પેદાશોનો ઈધાં તરીકે ઉપયોગ, દૂરસંદેશા વ્યવહારની રાખસી માપાજાળ અને વિકાસને ભૌતિક સુખસરાવડ સાથે ગુંચવતી પથબદ્ધ થયેલી સ્વકેન્દ્રી માનવજાત પોતે! - આ સમસ્યાઓનો ઉકેલ ક્યાં શોધવો?

અભયારણ્યો હવે આપણી વચ્ચે ઊભાં કરવાનાં છે; સામાજિક વ્યવસ્થા અને રાજકીય પ્રશાસનમાં ઊભાં કરવાનાં છે; આપણા જીવનમાં ઊભાં કરવાનાં છે; પ્રતેક બાળકના મનમાં ઊભાં કરવાનાં છે! 'હું આ મહાવિનાશક સંકટ સમયે ક્યાં હું ને કેવી રીતે ફાળો આપી શકું?' એ મનોમંથનની જરૂર છે.

'ચકલી'નું પતન એ આપણા આત્મવાતી અભિગમની સાબિતી છે. રહાં આપણી નાચ આવ્યા છે. ચકલી ના વિદ્યા માપણ અસ્તિત્વ પર મોટો પ્રશાર્થ છે.



વિહંગ


નિમાસિક

RNI Reg. No. GUJ/GUJ/2007/
20874 dt. 21-8-07

વર્ષ-૨ અંદ ૧ શિક્ષિક ૨૪૮૮

પચામર્યાંક સંપાદક
લાલકિંડ રાઓલ ડૉ. બુકુલ નિવેદી
સહસંપાદક : નાનિતા મુનિ
સંપાદક મંડળ
ડૉ. પી.એસ.દક્કર, ડૉ. કેતન રાઢ,
ડૉ. પીયુષ પટેલ, અશોક મશરૂ
મુખ્યપૃષ્ઠ સંજ્ઞાવટ : 'પગમાર્ક ક્યુભ્યુલસ કોન્સ્પોર્ટિયમ'
પત્રવહાર
૧૮/૪૧૪, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ રોડ,
અમદાવાદ-૩૮૦૦૧૫
E mail : vihangujarat@gmail.com
લવાજમ : વાર્ષિક રૂ. ૧૦૦૦-૦૦,
આજીવન રૂ. ૧૫૦૦-૦૦
(શુભેશ્વર ફાળો આવકાર્ય - 'વિહંગ રીસર્ચ ફાઉન્ડેશન
- Vihang Research Foundation'ના
નામે ચેક / ફ્રાઇટ અથવા મ.ઓ.થી. આ સંસ્થાને
મળેલા દાનો આવકેવા ધારાની કલમ ૮૦૪ ડેટાન
કરમુક્તિને પાત્ર છે.)

પ્રકાશક તથા મુદ્રક : ડૉ. બુકુલ નિવેદી, ૧૮/૪૧૪,
સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ રોડ, અમદાવાદ-
૩૮૦૦૧૫ માલિક : વિહંગ રીસર્ચ ફાઉન્ડેશન
કોમ્પ્લેક્સ, મેમનગર, અમદાવાદ ૩૮૦૦૫૨



દરિયાપુર દરવાજા બલાક, અમદાવાદ-૩૮૦૦૦૧.
બેસર ટાઇપ સેટેંગ : શારદ પ્રકાશન, પ્લ. સનપોર્ટન

વિહંગાવલોઘન

લવકુમાર ખાચર
અનુ. નંદિતા મુનિ

સારસની ચિરવિદાય?

ભરતપુર ખાતે યોજાયેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય કેન કાર્યશાળામાં મેં સારસના સંરક્ષણને અધિમતા આપવાની માગણી કરી હતી ત્યારે સૌને એ વાત નિરર્થક લાગી હતી. કાર્યશાળામાં ભાગ લેનારા બીજા સૌ સંખ્યો ખુશ હતા કારણ કે એ વર્ષે કેવલાદેવ ધાના રાષ્ટ્રીય ઉઘાનમાં સારસની પ્રજનનરત જોડીઓ વિકમજનક સંખ્યામાં એકત્ર થઈ હતી. પણ મને એમાં ખુશ થવા જેવું કંઈ લાગતું નહોંદું. મને તો આ સમાચાર ભવિષ્યમાં સર્જનારી સમસ્યાઓની આગોતરી ચેતવણીરૂપ લાગતા હતા. સારસ જેવાં મોટાં પક્ષી મોટા સમૂહમાં સફળ પ્રજનન કરી શકે એ અશક્ય છે; કારણ કે પુઅ પક્ષીઓમાં જગ્યા માટે તણાવ સર્જય જ. આ ઉપરાંત, સારસનાં બચ્યાંને લગભગ ગ્રાણ માસ જેટલા સમયમાં હ ફૂટનું કદ થાય એટલી શારીરિક વૃદ્ધિ સાધવા માટે આવશ્યક પ્રમાણમાં ખોરાકની ઉપલબ્ધિની સમસ્યા પણ સર્જય. આમ છતાં, આ સમૂહ એકત્રિત થવાથી ખાસ ફેર ન પડ્યો હોત - જો વીસમી સદીના મધ્યભાગ સુધી થતું હતું તેમ સારસનાં તમામ નિવાસસ્થાનોમાં તેમનું પ્રજનન સફળતાપૂર્વક સંપણ થયું હોત તો! દુર્ભિયવશ આવું બન્યું નહીં. રક્ષિત વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં સારસ એકઠાં થવાનું કારણ બિનસંરક્ષિત વિસ્તારમાં એમને પહોંચતી મોટી ખલેલો હતી. પચાસના દાયકામાં રસ્તાની બાજુની પાણી ભરાયેલી જે ખાડીઓમાં સારસની એકાઉ જોડીનો માણો તો દેખાઈ જ જતો, તે તમામ જગ્યાઓ ખેતીલાયક જમીન વધારવાની તૃણાનો ભોગ બની. પરંપરાગત રીતે ખેતરોમાં સારસયુગ્મોને જે સંરક્ષણ મળતું તે પણ બંધ થતા તેમની એ સલામત જગ્યા પણ છિનવાઈ ગઈ. સારસ અને ખેડૂત વચ્ચેનો સંબંધ હવે નકારાત્મક બની રહ્યો હતો અને પરિણામે સારસ આશરાની શોધમાં હતાં. મને લાગતું હતું કે, વધુ ને વધુ સંખ્યામાં સારસયુગલો ક્યાં

તો માત્ર એક જ બચ્યું ઉછેરતાં હતાં ક્યાં તો એક પણ નહીં. વીસમી સદીના ઉત્તરાર્ધમાં પણ સારસ, માનવની નજીક આસાનીથી વિચરતાં દેખાતાં એનું એક માત્ર કારણ એ હતું કે સારસ એક દીદ્ધજીવી પક્ષી છે અને ખાસ કરીને પુઅ વયનાં પક્ષીઓને ઓછાં સત્તાવાય છે. પણ આ કારણે પક્ષીનિરીક્ષકોમાં તેમના સંદર્ભે એક નિરાંતરની લાગણી જન્મી હતી. આ જ સમયે પ્રજનનશીલ સારસયુગ્મોને વિવિધ વિઘ્નો સહેવા પડતાં હતાં અને સારસની કુલ વસ્તીમાં દર વર્ષે ઉમેરાતાં યુવા પક્ષીઓની સંખ્યા ઉત્તરોત્તર ઘટી રહી હતી. સારસની સંખ્યામાં અચાનક થયેલ ઘટાડાનો પહેલેથી જ ખ્યાલ હોય એવી તો કદાચ બહુ ઓછી વ્યક્તિઓ હશે. આજે પણ આ ઘટાડા વિશે પૂરતી ચિંતા સેવાઈ રહી હોય તેવું મને નથી લાગતું. શિકારી પક્ષીઓ બાબતે જે બન્યું તેનું જ પુનરાવર્તન આ કિસ્સામાં થઈ રહ્યું છે.

ગુજરાતમાં વર્ષાક્રિતું દરમ્યાન કેટલાક વિસ્તારોમાં સારસ સારી એવી સંખ્યામાં પ્રજનન કરતાં હોય છે. એ ઉપરાંત, સદ્ગ્રાઘે આ સુંદર પક્ષીનો વ્યવસ્થિત અભ્યાસ કરતા વૈજ્ઞાનિકો અને શોખીનો પણ આપણો ત્યાં છે. પણ એ દુઃખની વાત છે કે હું જાણું છું ત્યાં સુધી, ઘણી પ્રસિદ્ધ પામેલી સારસ ગણતરીને બાદ કરતાં, વન્યજીવન વ્યવસ્થાપકો પાસે ભવિષ્યની કામગીરી માટે કોઈ રૂપરેખા કે આયોજન નથી. શક્ય તેટલી વધુ પ્રજનનરત જોડીઓને સંપૂર્ણ રક્ષણ મળે તે માટે સધન અભિયાન શરૂ કરવાની તાતી જરૂર છે. જે સ્થાનિક ખેડૂતોની જમીન પર સારસ માળો બનાવે છે તે ખેડૂતોને પણ આ અભિયાનમાં સંકળના જ રહ્યા; અને જરૂર હોય તો તેમના પાકને થતા વાસ્તવિક કે સંભવિત નુકસાનના વળતરુપે અને આ યુગ્મોના પજમાન બનવાની કદર તરીકે એમને કંઈક વળતર પણ આપવું જોઈએ. રાજ્યમાં

નાના ગડેરા (Bartailed Godwit)ની E-7 આવા નામાભિધાનવાળી એક માદા આજકાલ સમાચારોમાં જણકી રહી છે. E-7ને હિંદુઆરી ૨૦૦૭ના રોજ ન્યૂજીલેન્ડ્માં આવેલ થેમ્સની ખાડી પરના મિરાન્ડા નામના થથે સેટેલાઈટ ટ્રાન્સમિટર લગાડવામાં આવ્યું હતું. ૫૦૦ કલાકના ઉક્કેન અને ૨૮,૧૮૧ કિમીની મુસાફરી બાદ E-7 ઉસેભર, ૨૦૦૭ની સાંજે ફરી એ જ થથે પહોંચ્યો ગઈ છે. એના આ આશર્યજનક ઝતુપ્રવાસની વધુ વિગતો 'વિહંગ'ના વાચકોને આ વેબસાઈટ પરથી મળીરહેશે : <http://www.shorebirdnetwork.org/news070909migration.html>.

ચયન : નંદિતા મુનિ




ઉત્સાહી પક્ષીનિરીક્ષકોની જે મોટી સંખ્યા છે તે પણ આ પ્રવૃત્તિમાં મોટા પાયે સંકળાય તે જોવું જોઈએ. તેઓ માત્ર અમદાવાદ અને ખેડા જેવા અગત્યના જિલ્લાઓ ઉપરાંત રાજ્યની દૂરની જગ્યાઓ પર પણ નજર રાખી શકે. સારસ એક અંદું પક્ષી છે કે જેને સુધ્યોળ્ય રીતે પ્રસિદ્ધ અને લોકપ્રિયતા વરી શકે છે. આગળ જ્ઞાનેલા કાર્યક્રમ ઉપરાંત આપણે અમેરિકાના 'ઇન્ટરનેશનલ કેન ફાઉન્ડેશન (ICF)'ની સફળતામાંથી પ્રેરણા લઈને બંધનાવસ્થામાં સારસઉંઘેરનો કાર્યક્રમ ઘડવો જોઈએ. અંદું જોવા મળ્યું છે કે સારસના માળામાંથી એક ઈંડું લઈ લેતા આ પક્ષીઓ ખલેલ પામતાં નથી અને બીજાં ઈડાને

સેવવાનું યથાવતું ચાલુ રાખે છે. ઈંડું મૂકાયા બાદ જલદી લઈ લેવામાં આવે તો પક્ષી ઘણી વાર ગ્રીજું ઈંડું પણ મૂકે છે! માળામાંથી એક ઈંડું લઈને તેને કૃત્રિમ રીતે સેવવામાં આવે તો બસે બચ્ચાનો સફળતાપૂર્વક ઉછેર થવાની શક્યતા વધી જાય છે. 'કેન' પ્રજ્ઞાતિનાં બચ્ચામાં તીવ્ર આંતરિક સ્પર્ધા જોવા મળે છે અને નાનું બચ્ચું ન જીવે તે પૂરેપૂરું શક્ય છે - સિવાય કે એ જે જાળાલાવિત વિસ્તારમાં ઉછેરતાં હોય તે વિશાળ હોય અને નર તથા માદા દરેક બચ્ચાને બીજા બચ્ચાથી દૂર, ખોરાક મેળવવા માટે લઈ જઈ શકતા હોય.

(કમશાસ)

૧૪, જ્યંત સોસાયરી, રાજકોટ ૩૬૪૦૦૪

નિરીક્ષણ નોંધ



કચ્છમાં આ શિયાળામાં સરૂંઘૂલ (Short-toed Lark)ની નોંધપાત્ર સંખ્યા

કચ્છમાં ૨૦૦૬માં પેલા પુષ્ટ વરસાદને કારણે અનેક વનસ્પતિ / ધાસ ઊર્ધ્વ નીકળતાં તેમના દાઢા / બીજનો આહાર કરવા આવી પહોંચેલ સરૂંઘૂલનાં ધાડાં આ વરસે કચ્છમાં જોવા મળેલ. તે અંગેની માહિતી રસમદ બની રહેશે.

તારીખ	સ્થળ	સંખ્યા
૩-૮-૦૬	નાંદાબેટ (કચ્છનું નાનું રણ)	૧૨
	તા. રાપર	૪૮તુનો પ્રથમ
૨૮-૧૦-૦૬	શેરવો-વેકરીયા વચ્ચે (બન્ધી, તા. ભુજ)	૧૦૦
૨૮-૧૦-૦૬	ભીરણીયારા - સરગુ વચ્ચે (બન્ધી)	૬
૧૨-૧૧-૦૬	શેરવો - છારીદંડ વચ્ચે (બન્ધી)	૫૦
૧૩-૧૧-૦૬	બીજા-કુણાઠીયા વચ્ચે (તા. અબડાસા)	૩૦
૧૩-૧૧-૦૬	પીંગળેશ્વર- કોઠારા વચ્ચે (તા. અબડાસા)	૧૦
૧૪-૧૧-૦૬	કીરો હુગર, છારીદંડ નજીક (તા. નખગાણા)	૨૦
૧૭-૧૧-૦૬	કૂલાય-છારીદંડ વચ્ચે	૫૦
૧૮-૧૧-૦૬	પીંગળેશ્વર-કોઠારા વચ્ચે	૫૦
૧૮-૧૧-૦૬	કાળા તળાવ (તા. અબડાસા)	૩૦
૨૬-૧૧-૦૬	માપર (તા. માંડવી)	૫૦

૨૬-૧૧-૦૬	મોટી રાયણ - દુર્ગાપુર વચ્ચે	૨૦
(તા. માંડવી)		
૩-૧૨-૦૬	લાલા, બુડીયા, સુથરી	૮૦
(તા. અબડાસા)		
૧૦-૧૨-૦૬	વાંકુ (તા. અબડાસા)	૧૦૦
૨૩-૧૨-૦૬	હોડકા ઠઠ, શેરવો (બન્ધી)	૮૦
૨૪-૧૨-૦૬	બીજાથી કુણાઠીયા, કાળા	૧૦૨૦
	તળાવ, સુતંધ્રો, વિધાબેર, લાલા	
	રાણપર રખાલ, લાલા - જખૌ	
	વચ્ચે તથા બુડીયા તા. અબડાસા	
	(અબડાસાનો ધાસિયો પ્રદેશ)	
૩૦-૧૨-૦૬	બાંબડાઈ, તા. માંડવી	૫૦
૩૦-૧૨-૦૬	સાંધાણા, સુથરી, પરજાઉ,	૧૭૨
	વિધાબેર, લાલા અને લાલા	
	ઘોરાડ અભ્યારણ્ય (તા. અબડાસા)	
૧૩-૧-૦૭	પોલાડીયા, તા. માંડવી	૧૦૦
૨૭-૧-૦૭	સરી, તા. રાપર	૬૦
૨૭-૧-૦૭	ફિલેખગઢ થી શિવગઢ, તા. રાપર	૪૦
૨૭-૧-૦૭	બાલાસર, તા. રાપર	૧૫૦
૨૮-૧-૦૭	રવેચી, તા. રાપર	૫૦
૩૧-૧-૦૭	ભાનાડા, કાળા તળાવ,	૩૫૦
	કુણાઠીયા (તા. અબડાસા)	
૧-૨-૦૭	કુણાઠીયા, ભીરીયારી, રાણપર	૧૨૫૦
	રખાલ, નલિયા, જસાપર, લાલા	
	(નલિયાનો ધાસિયો પ્રદેશ)	

નિરીક્ષણ નોંધ

૫-૨-૦૭	પોલાડીયા, તા. માંડવી	૩૦	૧૭-૧૧-૦૬	ભગાડીયા ઠઠ (બની)	૫૦
૫-૨-૦૭	ગંગાનાળ, માંડવી	૧૦૦	૧૨-૧૧-૦૬	હોડકા ઠઠ (બની)	૩૦૦
૧૮-૨-૦૭	કુલાય, છારી, હોડકા, છછલો સેરવો (બની)	૬૦	૧૮-૨-૦૭	"	૬૦
૨૧-૨-૦૭	વાધોટ-રામવાડા વચ્ચે (તા. અબડાસા)	૨૦૦	૧૩-૧૧-૦૬	બીંઢા, ઘુફી, કુણાડીયા, કાળા તળાવ, ભાનાડા (તા. અબડાસા)	૬
૨૧-૧-૦૭	લાલા-વાંકુ વચ્ચે (તા. અબડાસા)	૨૦	૧૮-૧૧-૦૬	"	૨૮
૨૧-૨-૦૭	સુખપર- ચોપડી વચ્ચે "	૨૦	૩૧-૧-૦૭	"	૮
૧૧-૩-૦૭	સાંખણા - સુથરી વચ્ચે "	૫૦	૧૩-૧૧-૦૬	પીગળોશર, કોણારા, વાંકુ, લાલા બુરીયા, રાજાપર રખાલ (તા. અબડાસા)	૨૦૩
૧૧-૩-૦૭	લાલા (તા. અબડાસા)	૨૦	૩-૧૨-૦૬	"	૧૦
	અતુના છેલ્લા		૧૦-૧૨-૦૬	"	૨૧૦



કચ્છમાં આ વરસે કુંજની સારી જમાવટ

આ વરસે સમગ્ર કચ્છમાં સારો વરસાદ પડવાથી શિયાળુ પ્રવાસી કુંજ (Common Crane)ની સંખ્યા સારી જોવામાં આવેલ છે. આ અંગેની માહિતી પક્ષીપ્રેમીઓને ગમશે.

તારીખ	સ્થળ	સંખ્યા	તારીખ	સ્થળ	સંખ્યા
૨૮-૧૦-૦૬	નેરી - કુંજેવાડી ઠઠ વચ્ચે (બની)	૬	૨૭-૧-૦૭	દુધઈ, સામખીયાળી (તા. ભયાડુ)	૩૫
૨૮-૧૦-૦૬	ખીરજોગ ઢંઢ (બની)	૨૫	૨૭-૧-૦૭	ફેલગઢ, શિવગઢ, પ્રજવાહી બાલાસર, રવ (તા. રાપર)	૪૦૫
૨૮-૧૦-૦૬	સેરવો ઢંઢ (બની)	૩૩૦	૧૩-૧-૦૭	વિજયસાગર ડેમ (તા. માંડવી)	૧૦૦
૧૨-૧૧-૦૬	"	૨૦	૨૭-૧-૦૭	દુધઈ, સામખીયાળી (તા. ભયાડુ)	૩૫
૧૭-૧૧-૦૬	"	૧૦	૨૮-૧-૦૭	લોધાણી, અમરાપર, બાંમડકા, ઘોળાવીરા (ખડીર, તા. ભયાડુ)	૨૮
૧૮-૨-૦૭	(સાંજના સમયે)	૮૦૦૦	૨૭-૧-૦૭	પાસાસર તળાવ (તા. રાપર)	૨૨
૧૨-૧૧-૦૬	છારીઢંઢ, કોરો કુંગર, કુલાય (તા. નખત્રાણા)	૨૦	૨૧-૨-૦૭	મોટીબેર ડેમ (તા. અબડાસા)	૧૭૦
૧૪-૧૧-૦૬	"	૪૦૦	૨૧-૧-૦૭	રામપર, વાધોટ, રામવાડા (તા. અબડાસા)	૨૨૩
૧૬-૧૧-૦૬	"	૭૦			
૧૭-૧૧-૦૬	"	૩૫			
૧૮-૧૧-૦૬	"	૮૦			
૨૧-૧૧-૦૬	"	૬૦			
૩૧-૧૨-૦૬	"	૨૫			
૩-૧-૦૭	"	૧૦૦			
૪-૧-૦૭	"	૫			
૧૪-૨-૦૭	"	૫૦			
૧૮-૨-૦૭	(સાંજના સમયે)	૩૪૦૦			
૧૦-૩-૦૭	"	૩૦૦			
૨૮-૧૦-૦૬	વેકરીયા ઢંઢ (બની)	૫૦			
૧૪-૧૧-૦૬	"	૭૦			
૧૪-૧૧-૦૬	ભગાડીયા ઠઠ (બની)	૧૦૦			



અમુક શિયાળુ યાયાવર પક્ષીઓનાં ઘણાં વરસો બાદ દર્શન

મારા ઓગસ્ટ, ૦૮થી માર્ચ, ૦૭ દરમ્યાનના કચ્છમાં પક્ષીનિરીક્ષણ વખતે અમુક શિયાળુ યાયાવર પક્ષીઓ ઘણાં વરસ બાદ જોવાં મળેલાં છે, તે સારા વરસાદનું પરિણામ હોવું જોઈએ. આ અંગેની માહિતી પક્ષીનિરીક્ષકોને ગમશે.

નિર્જાસા નોંધ

અનુ- સ્થળ તારીખ (સંખ્યા ક્રમ)	છેલ્લે જોયેલ તેની વિગત	ઇન્દ્રાચિંદ્ર ૧૮-૨-૦૭ (૧) સેરવો હંડ ૧૮-૨-૦૭ (૧) હોડકા ૬૬ ૧૮-૨-૦૭ (૧)
૧. સફેદ ઢોક (White Stork)		૭. નાની દરિયાઈ વાખગલી (Lesser Crested Tern)
હોડકા હંડ (બન્ની): ૨૩-૧૨-૦૬ (૩)	તા. ૨૬-૨-૦૦ના રોજ ઇન્દ્રાચિંદ્ર ખાતે ૧ પક્ષી	ભદ્રેશ્વર દરિયાકિનારો ૫-૨-૦૭ (૨૦)
ઇન્દ્રાચિંદ્ર: ૨૩-૧૨-૦૬ (૩) ૩૧-૧૨-૦૬ (૧) ૪-૧-૦૭ (૧)	જોયેલ. આમ હ વર્ષ બાદ આ પક્ષી કચ્છમાં જોવા મળેલ.	જખાનો દરિયાકિનારો તા. ૧૭-૨-૦૨ (૧૫). આમ પ વરસ બાદ આ પક્ષી કચ્છમાં જોવા મળેલ.
લોરીમા - ભીરંગીમારા વચ્ચે: ૩૧-૧૨-૦૬ (૭)	૧૦-૩-૦૭ (૨)	
નિગળાણ તળાવ (તા. અંજાર) ૨૧-૧-૦૭ (૬)		
સેરવો હંડ (બન્ની) ૧૮-૨-૦૭ (૨૮)		
૨. કાળો ઢોક (Black Stork)		૮. ટિલોર (Houbara)
મોટી બેર ડેમ (તા. અબડાસા)	સેરવો હંડ ખાતે તા. ૨૨-૨૧-૨-૦૭ (૧)	ભગાડીયો - સેરવો વચ્ચે (બન્ની) ઠાડડા - લાયજા વચ્ચે ૧૪-૧-૧-૦૮ (૩) તા. ૧૪-૧-૧૮૦ (૩).
	૨-૮૮ના રોજ ૨ પક્ષીઓ જોયેલ. ૮ વરસ બાદ કચ્છમાં આ પક્ષી જોવા મળેલ.	રાણાપર રખાલ (તા. અબડાસા) ૧૬ વરસ બાદ આ પક્ષી ૨૪-૧૨-૦૬ (૬) કચ્છમાં જોવા મળેલ.
૩. મોટો સદ્ગ ચંદ્રૂલ (Bimaculated Lark)		શાંતિલાલ એન. વરુ
ફેટેહગઢ બીડ (તા. રાપર) ૨૭-૧-૦૭ (૬)	ઇન્દ્રાચિંદ્ર તા. ૧૩-૧૨-૮૩ (૩). આમ ૧૪	જૂના વાસ, મંદિરવાળો ખાંચો, માથાપર, ભુજ ૩૭૦૦૨૦
ભાનાડા ઘાસીયો મૃદેશ, તા. અબડાસા ૩૧-૧-૦૭ (૫)	વર્ષ બાદ કચ્છમાં આ પક્ષી જોવા મળેલ.	
કુષાંગીયા (તા. અબડાસા) ૧-૨-૦૭ (૨૦)		
૪. લાલપુંજ પિંડો (Redtailed Chat)		
પાંખીભીટ ફૂલાય	કાળો કુંગર તા. ૮-૧૦-૧૪-૨-૦૭ (૨)	
૧૮-૨-૦૭ (૨)	૮૮ (૨). આમ ૧૮	
૧૮-૨-૦૭ (૨)	વરસ બાદ આ પક્ષી	
૧૦-૩-૦૭ (૧)	કચ્છમાં જોવા મળેલ.	
૫. રવાઈડો (Short-eared Owl)		
ફેટેહગઢ બીડ (તા. રાપર) ૨૭-૧-૦૭ (૨)	ધોરડો (બન્ની) તા. ૪-૧૧-૮૨ (૧). આમં	
સેરવો હોડકા વચ્ચે (બુન્ની) ૧૮-૨-૦૭ (૬)	૧૪ વરસ બાદ આ પક્ષી કચ્છમાં જોવા મળેલ.	
૬. મોટો કાળો સુભ્રમસ (Greater Spotted Eagle)		
નિગળાણ તળાવ (તા. અંજાર) ૨૧-૧-૦૭ (૧)	રાપર ડેમ તા. ૨૬-૧-૮૪ (૨૧). આમ ૧૩	
બાંબડકા ડેમ (ખડીર) ૨૮-૧-૦૭ (૧)	વરસ બાદ આ પક્ષી કચ્છમાં જોવા મળેલ.	



સફેદ કંકણસારનું ટોળું

તા. ૧૪-૩-૦૭ના રોજ સવારે દ્વારિકાથી ૮-૧૫ વાંચે ઉપડતી ખાનગી બસમાં કોસ્ટલ હાઈવે પરથી સોમનાથ જતા હર્ષિદા માતા પાસે ૧૧ વાંચે એક ખેતરમાં, સફેદ કંકણસાર (Oriental White Ibis)નું એક ટોળું જોયું. ચાલુ બસે ગડાતરી તો ન થઈ શકે, પરંતુ કંકણસારની સંખ્યા ખાસી હતી. વિચાર આવ્યો કે તે શું ટોળામાં રહે? ત્યારે યાદ આવ્યું કે આશરે ચારેક વરસ પહેલા નર્મદા નદીએ ફરવા જતા ત્યારે ચૈત્ર માસમાં, સુદ/વદ છઠ, સાતમ કે આઠમના દિવસે નદીમાં પાણી ઓછું રહેતું. આવે વખતે એક વાર સાંજે ચારેક વાંચે ભગવી સુરખાબને (Brahminy Shelduck) કલ્યાણ શકાય એટલી મોટી સંખ્યામાં જોઈ હતી. બહુ જ ડરપોક. સહેજ પડ્યા હિલચાલ થતા ઊરી જાય. જો કે ત્યારે બાદ નદીએ ફરવા જવાનું શક્ય બન્યું નથી.

એ.કે.દેસાઈ

૧૨, દીક્ષી સ્ક્રીટ, જીઅનઅનેક્સી ટાઉનશીપ, ભરુચ ૩૮૨૦૧૫
કાંકણસારની વાતાવરણ પક્ષીનિરીક્ષણ

વરસાદી વાતાવરણ જામી રહ્યું છે, ત્યારે કરેલા પક્ષીનિરીક્ષણની નોંધ મોકલું દ્ધું.

તા. ૨૦-૬-૦૭ના રોજ ભોયચકલી (Ashy-crowned Sparrow Lark) - ૨, કાબરી રામચકલી (Pied Tit) - ૨, નાનો રાજલાલ (Small Minivet) - ૭, ચાતક (Pied Crested Cuckoo) - ૧, કાબરો લક્કડખોડ (Yellow-fronted Pied Woodpecker) -

ત - આ તમામ પક્ષીઓ કોટીથી ભીમનાથની વચ્ચે આવેલી રખાલમાં જોવા મળેલ.

દીપક વી. ગોસ્વામી

મુ. પો. કોટી (મહા.), તા. માંડવી-કચ્છ



વૈયાંની મોટી સંખ્યા

શનિવાર, ૩૧ માર્ચની સાંજે આણંદથી ડૉ. રંકનો ફોન આવ્યો, “૧ એપ્રિલની સાંજે ૪-૦૦ વાગે, વરોદરા જવાનું છે. ગોત્રી પાસેના કોઈ વિસ્તારમાં મોટા વૃક્ષો ઉપર છેલ્લા બે હિવસથી વૈયાં (Rosy Starling)નો ખૂબ જ મોટો સમૂહ રાત્રિરોકાણ (roosting) માટે હોય છે. ૧ એપ્રિલના રવિવાર હોવાથી તે પહેલેથી જ આરક્ષિત હતો. એક સાથે દોઢથી બે લાખ વૈયાં નહીં જોઈ શકવાનો અફ્સોસ વ્યક્ત કરી ડૉ. રંકને ફરી કોઈ વાર કહી, અટકવું પડ્યું.

કોઈ પણ એક જ જીતનાં પક્ષીનો આટલો મોટો સમૂહ જોવાનું ચૂકી જવાનો અફ્સોસ લાંબો વખત ન ટક્યો. રોજ સવારે રેઝિઓ ઉપર ‘પ્રકૃતિ’ કાર્યક્રમ સાંભળવાની ટેવ હોવાથી તેની આગળ પાછળના કાર્યક્રમ પણ સાંભળવા મળે જ. ૧૩ એપ્રિલની સવારે બેડા જિલ્લાનો પત્ર હેમલતાને રજુ કર્યો. તેમાં સાંભળ્યું કે ‘નિર્યાદ પાસેના પીપળાતા ગામે અઢીથી ત્રણ લાખ વૈયાં રોજ જોવા મળે છે.’ તરત જ પીપળાતા રહેતા મારા મિત્ર ડૉ. અનિલ પટેલને ફોન કર્યો. તો તેમણે કહ્યું, ‘હા, મારા બંગલાની સામેનાં વૃક્ષો ઉપર રોજ ‘ફગલે ફગલા’ પંખીઓ હોય છે. તરત જ કાર્યક્રમ નક્કી કરી રવિવાર, ૧૫ એપ્રિલ સાંજે સહપરિવાર પીપળાતા પહોંચા. ત્યાં પહોંચતા જ પક્ષી/પ્રકૃતિપ્રેમી અમે (હું, ગાયત્રી, હિમાદ્રી, પ્રયાગ) આ અદ્ભુત અલૌકિક દશ્ય જોઈને રોમાંચિત થઈ ઉંકયા. એક સાથે બેથી અઢી લાખ (કદાચ તેથી પણ વધારે) વૈયાંનાં અવાજથી વાતાવરણ ખૂબ જ જીવંત બની ગયું હતું. આહ! અને વાહ! આ બે જ શન્દો મમળાવતા રાત્રે નિર્યાદ પાછા ફર્યા.

ડૉ. તરણ જોશી, ડૉ. ગાયત્રી જોશી, હિમાદ્રી, પ્રયાગ
‘નૂતન’ ૩/૧, નિત્યાનંદનગર, ટેલીકોન જવન સામે,
પીજ રોડ, નિર્યાદ.



નરારાની મુલાકાત

તા. ૧૩-૦૪-૦૭ના રોજ જીમનગરના શ્રી કુણાલ જોશીએ જીમનગર જિલ્લામાં નરારા વિસ્તારની મુલાકાત કરાવી. મુલાકાત દરમ્યાન નિહાળેલા વિવિધ પંખીઓની નોંધ આ પ્રમાણે છે :

નાની ખલિલી (Whimbrel), મલ્સ્યભોજ (Osprey), ભૂલામણી ઢોંગીલી (Kentish Plover), મોટી ઢોંગીલી (Greater Sand Plover), નાનો કાજિયો (Little Cormorant), દરિયાઈ બગલો (Reef Heron), કબૂત બગલો (Grey Heron), મોટો ધોમડો (Pallas's Gull), પીળાપગ ધોમડો (Yellowlegged Gull), કાળીપીઠ ધોમડો (Heuglin's Gull), મોટી વાબગલી (Caspian Tern), નાની દરિયાઈ વાબગલી (Lesser Crested Tern), ધોળી વાબગલી (Gull-billed Tern), ખલિલી (Eurasian Curlew), નાની ઢોંગીલી (Lesser Sand Plover), કણાપગ કીચરિયો (Little Stint), ચાતાપગ (Common Redshank), અબલાખ (Eurasian Oystercatcher), નાની તુતવારી (Common Sandpiper). (પક્ષીઓની આશરે સંખ્યા જરૂરી. - સ.)

કૃ.ડી.નિમાવત

બ્લોક નં. ૩/૪૧, સેન્ટ્રલ ગવ. ક્વાર્ટર્સ, નારણપુરા, અમદાવાદ ૧૩



બી.સી.એસ.જી., દાહોદ ચેપ્ટરનો કાર્યક્રમ

રવિવાર, તા. ૩-૧૨-૦૬ : દાહોદથી ૩૦ કિમી દૂર આવેલ માછળા જળાશય મુકામે પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદના તર સભ્યો, BCSG દાહોદ ચેપ્ટર અંતર્ગત પક્ષીનિરીક્ષણ માટે ગયા હતા. સવારના ૭-૧૫ કલાકે સ્થળ ઉપર પહોંચી ત્યાં નીચે મુજબનાં પક્ષીઓ જોવાં.

ચોટીલી કારચિયા (Tufted Pochard) - ૨, લુહાર (Gadwall) - ૧૦૦+, ભગવી સુરખાબ (Brahminy Shelduck) - ૧૩૦+, ગયણો (Northern Shoveler) - ૫૦, ચેતવા (Garganey) - ૭૨, સીંગપર (Northern Pintail) - ૬૬, નાની ઝુબકી (Little Grebe) - ૮, નાની કાંકણસાર (Glossy Ibis) - ૨૧, ગ્રાજી (Cotton Teal) - ૬૦+, રાખોડી કારચિયા (Common Pochard) - ૧૮, નાનો ધોળો બગલો (Little Egret) - ૨૦+, મોટો ધોળો બગલો (Large Egret) - ૨, ફાટીચાંચ હોંક (Openbill Stork) - ૧૧, નાનો કાજિયો (Little Cormorant) - ૧૦૦+, વચેટ કાજિયો (Indian Shag) - ૧૮, ભગતંતું (Common Coot) - ૫૦૦+, ગજપાઉ (Black-winged Stilt) - ૨૬, પાનપર્કાઈ (Marsh Harrier) - ૫, મોટું તેજપર (Collared Pratincole) - ૨૦૦+, કણાપગ કીચરિયો (Little Stint) - ૫૦+, ટીલિયો (Ruff) - ૩૦૦+, ધોળી

વાબગલી (Gull-billed Tern) - ૧૮, કાબરો કલકલિયો (Lesser Pied Kingfisher) - ૪, નાનો કલકલિયો (Small Blue Kingfisher) - ૩, ટીલિયાળી બતક (Spotbilled Duck) - ૭, કલકલિયો (White-breasted Kingfisher) - ૩, કેંચીપુંછ વાબગલી (River Tern) - ૮, નાની તુતવારી (Common Sandpiper) - ૧૦, ભૂલામણી ઢોંગલી (Kentish Plover) - ૩, કંઠલાવાળી નાની ઢોંગલી (Little Ringed Plover) - ૫૦+, પીળાડિયો (Yellow Wagtail) - ૨૦+, પીતશિર પીળાડિયો (Citrine Wagtail) - ૧૫+.

આ જળાશય ખૂબ જ વિશાળ છે અને વધુમાં સારા ચોમાસાને લઈને પાણી પણ ખાસ્યું છે. ઘણા વિસ્તારોમાં જઈ ન શક્યું, એટલે બધી બાજુથી સર્વેક્ષણ નથી થઈ શક્યું, પણ લગભગ ત્રણ બાજુનેથી પક્ષીઓ જોયાં - નોંધાં છે. ખામલો, રણિસાર, ટાંડી અને નાનસલાઈ વિસ્તારમાંથી આટલાં પક્ષીઓ જોઈ શકાયાં છે. સવારના ૧૧-૩૦ કલાક સુધી પક્ષીઓ જોયાં. દર વર્ષ કરતાં પક્ષીઓની સંખ્યા ઓછી દેખાઈ છે, પણ વિવિધતા વધુ જોવા મળી છે.

મુકૃતિ મિત્રમંડળ

૨૪, વૃન્દાવન સોસાયરી, માર્કેટ રોડ, દાહોદ ૩૮૮૧૫૧



જાસોરમાં રાજહંસ

તા. ૧૮-૩-૨૦૦૭ના રોજ જાસોર 'કેમ્પસાઈટ' આગળ આવેલા તળાવમાં બપોરે ૩-૧૭ વાગ્યે એક રાજહંસ (Bar-headed Goose) જોયો. (જાસોર અભયારણ બનાસકાંઠા જિલ્લામાં, પાલનપુર નજીક આવેલું છે. - સં.)

દીવા મુનિ

બ્લોક નં. ૩/૧, સેક્ટર ૪-એ, ગાંધીનગર ૩૮૨૦૦૪



બી.સી.એસ.જી. રાજકોટ ચોપટર -

પક્ષીનિરીક્ષણ કાર્યક્રમ

તા. ૧૧-૨-૦૭ના રોજ બી.સી.એસ.જી. રાજકોટ ચોપટર દ્વારા ઈશ્વરિયા તળાવ ખાતે પક્ષીનિરીક્ષણ કાર્યક્રમ યોજાયેલો. ૧૫ જેટલા પક્ષી-પ્રેમી મિત્રોને વિવિધ યાયાવર તેમજ સ્થાનિક પક્ષીઓનો ટેલીસ્કોપથી પરિચય કરાવાયેલો, તેમાં ગયણો (Northern Shoveller), પિયાસણ (Eurasian Wigeon), સીગપર (Northern Pintail), લુહાર (Gadwall), ચોટીલી કારચિયા (Tufted Pochard), ધોળીઅંખ કારચિયા (Ferruginous Pochard), ચાંઝોરી કારચિયા (Common Pochard), ચેતવા (Garganey), ભગવી સુરખાબ (Brahminy Shelduck) તેમજ સ્થાનિક બતકોમાં નકટા (Comb Duck), ગિરજા (Cotton Teal), નાની સિસોટી બતક (Lesser Whistling Teal) જોવા મળેલ હતી. સૌથી મોટી સંખ્યા ગયણાની આજી-૨ ખાતે ૧૧૦૦ની હતી અને ત્યાર બાદ ભગતડાં (Coot) ૧૦૦૦ની સંખ્યામાંથી આજી-૨ તથા રાંદરડામાં હતાં. ક્રીચડિયા (waders)માં ટીલિયા (Ruff) અને કાળીપુંછ ગડેરા (Blacktailed Godwit)ની સંખ્યા નોંધાત્ર હતી. દરિયાકાંઠ જોવા મળતો મોટો ધોમડો (Pallas's Gull) આજી-૨ ખાતે નોંધાયો હતો. આ ગણતરીમાં મારી સાથે

Pelican) અને દ રૂપેરી પેણ (Dalmatian Pelican) જોઈને બાળકો ખૂબ આનંદિત થઈ ગયાં! એક વૃક્ષ પર બેઠેલ લરજી (Common Kestrel) ખૂબ નજીક જવા છતાં ઉરી નહીં, કદાચ અપુખ હોઈ શકે.



પાનપડ્હાઈ (Marsh Harrier) દ્વારા બગલાનો શિકાર

તા. ૧૧-૨-૦૭ના BCSGના રાજકોટ ચોપટના પક્ષીનિરીક્ષણના કાર્યક્રમ દરમિયાન એક રસપદ ઘટના જોઈ. એક પાનપડ્હાઈએ નાના બગલા (Little Egret) પર બે વખત ખુમલો કર્યો. પણ તેને પંજામાં દબાવી પાડીમાં દૂબાડી તેની પર ૧૦ મિનિટ બેસી રહી. જ્યારે તેને ખ્યાલ આવ્યો કે બગલો મરી ગયો છે, ત્યારે આરામથી નજીકના એક જાડ પર બેસી પાંખોમાંથી પાણી ઉડાડી સાફ કરવા લાગી. પેલો મરેલો બગલો તરતો તરતો ડિનારા તરફ જવા માંડ્યો. ૧૦ મિનિટ બાદ તેને પંજાથી ઉપાડવા પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગઈ અને ફરી જાડ પર બેસી ગઈ. થોડી વારે બગલાને પંજામાં ઉપાડી માંડમાંડ ડિનારે પહોંચેલી બેસી ગઈ. ફરી ઉપાડી થોડી ઊંચી જગ્યાએ બેસી 'લંચ' લેવાનું શરૂ કર્યું.



શ્રેયાણ પક્ષીગણતરી

જાન્યુઆરી-ફેબ્રુઆરી ૦૭માં રાજકોટ આસપાસના ઈશ્વરિયા, આજી-૨, લાલપરી, રાંદરડા તથા ન્યારી-૧ ડેમમાં પક્ષીગણતરી કરાયેલ હતી. આ પક્ષીગણતરીમાં મુખ્ય યાયાવરી બતકોમાં ગયણો (Northern Shoveler), પિયાસણ (Eurasian Wigeon), સીગપર (Northern Pintail), લુહાર (Gadwall), ચોટીલી કારચિયા (Tufted Pochard), ધોળીઅંખ કારચિયા (Ferruginous Pochard), ચાંઝોરી કારચિયા (Common Pochard), ચેતવા (Garganey), ભગવી સુરખાબ (Brahminy Shelduck) તેમજ સ્થાનિક બતકોમાં નકટા (Comb Duck), ગિરજા (Cotton Teal), નાની સિસોટી બતક (Lesser Whistling Teal) જોવા મળેલ હતી. સૌથી મોટી સંખ્યા ગયણાની આજી-૨ ખાતે ૧૧૦૦ની હતી અને ત્યાર બાદ ભગતડાં (Coot) ૧૦૦૦ની સંખ્યામાંથી આજી-૨ તથા રાંદરડામાં હતાં. ક્રીચડિયા (waders)માં ટીલિયા (Ruff) અને કાળીપુંછ ગડેરા (Blacktailed Godwit)ની સંખ્યા નોંધાત્ર હતી. દરિયાકાંઠ જોવા મળતો મોટો ધોમડો (Pallas's Gull) આજી-૨ ખાતે નોંધાયો હતો. આ ગણતરીમાં મારી સાથે

શ્રી રાજદીપ જાલા તથા શ્રી રવિ આરદેશભા હતા.

મત્સ્યભોજ (Osprey)

આ શિયાળામાં મને થયું કે મત્સ્યભોજ શું જોવા નહીં મળે? પરંતુ છેલ્લે છેલ્લે તેણે દર્શન દઈ દીધાં. તા. ૨૪-૨-૦૭ના રોજ ઈશ્વરિયા તળાવમાં જોયો અને તા. ૧૧-૩-૦૭ના રોજ રાંદરડા તળાવમાં સુંદર પુખું વેશભૂષામાં સાંઠીકરે બેસી આરામ કરતો દૂરભીનથી નિરાતે જોયો. તા. ૨૬-૬-૦૭ના રોજ શ્રી ઈંડ્રભાઈ ગઢવી અને શ્રી કમલ

બહુને રાજકોટનું રલ રાંદરડા દેખાડવા માટે લઈ ગયેલ ત્યારે પણ ઈંડ્રભાઈએ આ શિયાળું મુલાકાતીને સાંઠીકરે બેઠેલો શોધી કાઢેલો. કદાચ ગમી જવાથી રોકાઈ ગયો હશે!



સારસ (Sarus Crane)

આ વર્ષે પણ સારસે વાપદો પાણ્યો છે. તા. ૮-૪-૦૭ના મર્યાદ-૨ બંધ ડેટણની નદીમાં ભાર્ગવ સાથે કરેલ 'ફ્રેંકિંગ' બાદ પાછા ફરતા, ૪ કિમી દૂર પાણી પીવા ઉત્તરેલાં

મોટીચાંચ પાન-કરકરિયા (Large-billed Reed Warbler)ની પુનઃ ખોજ

ભારતનું જે પક્ષી છેલ્લે ૧૪૦ વર્ષો પહેલા જીવતું જોવા મળેલ તેને એક બ્રિટિશ વૈજ્ઞાનિકે થાઈલેન્ડ ખાતે ખોળી કાઢ્યું છે.

મોટીચાંચ પાન-કરકરિયો એ એક નાનું, સામાન્ય, બદામી રંગનું, બહુ ઓદ્ધું જાણીતું પક્ષી છે. સામાન્ય દેખાવ ધરાવતા આ નાનકડા પક્ષીની પુનઃ ખોજના સમાચારથી દુનિયાભરના પક્ષીશાસ્ત્રીઓમાં ઉતેજના ફેલાઈ છે.

થાઈલેન્ડની રાજ્યાનીથી દક્ષિણ-પશ્ચિમે આવેલ એક પ્રદૂષિત પાણીના ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર પક્ષીઓને કરી પહેરાવવાનું કામ (ringing) કરતા કરતા મહીડેલ યુનિવર્સિટી, બેંગકોકના જીવવિજ્ઞાનના પ્રાધ્યાપક ફિલિપ રાઉન્ડ દ્વારા અચાનક આ ખોજ થઈ. તે કહે છે : "પાન કરકરિયા (Reed Warblers) સામાન્યતા: અનાકર્ષક અને એકસરખા દેખાય છે. પરંતુ તે દિવસે સવારે પકડાયેલાં પક્ષીઓ પૈકી એક મને કંઈક અસાધારણ જાણાયું. તે લાંબી ચાંચ અને ટૂંકી પાંખો ધરાવતું હતું. મારા હાથમાં મોટીચાંચ પાન-કરકરિયો હતો! હું એટલો હિંમૂલ થઈ ગયો જાણો કે મેં મારા હાથમાં જીવત ડોડો પક્ષી પકડ્યું ન હોય!"

ઇ ઈચ્છા લંબાઈ અને ૦.૩ ઔસનું વજનનું આ નર પક્ષી એકાદ વર્ષનું હોય તેમ જાણાતું હતું. અદ્યા ઈચ્છા ચાંચ ધરાવતા પક્ષી માટે "મોટીચાંચ" શબ્દપ્રયોગ સાપેક્ષ છે. પ્રો. રાઉન્ડ ડી. એન. એ. પરીક્ષણ માટે બે પીછા કાઢી તેને મોટીચાંચ પાન-કરકરિયાના હયાત એક માત્ર નમૂના જે ૧૮૬૭માં વાયવ્ય ભારતની સતતજ નદીના મેદાનમાંથી મેળવાયેલા - તેની સાથે સરખાવી ઓળખ સાબિત કરી. પ્રો. રાઉન્ડ, જે થાઈ વિસ્તારનાં પક્ષીઓના અચ્ચિમ નિષ્ણાત ગણાય છે, તે કહે છે, "હું ખરેખર ઉતેજિત હતો. મને આ પક્ષીના અસ્તિત્વની વાચન અને જૂના સંદર્ભોથી જાણ હતી, પરંતુ મેં ક્યારેય કલ્યાણ ન હતું કે તે અહીં મળી જશે! તે વિલુમ મનાતું હતું. પરંતુ હવે તેનું અસ્તિત્વ સાબિત થઈ ચૂક્યું છે."

પ્રો. રાઉન્ડની માર્ય માસની ખોજ પછી કેટલાક મહિને બીજું પક્ષી ટ્રિંગ, હર્ટજ (યુ.કે.)માં મળી આવ્યું, જે કે મરેલું. તેને એક નવાસવા પક્ષી-વૈજ્ઞાનિક શહેરના નેચરલ હિસ્ટરી મ્યુઝિયમના નાના પાન-કરકરિયા (Blyth's Reed Warbler)ના નમૂના ભરેલા એક ખાનામાંથી શોધી કાઢ્યું. આ પક્ષી ઈ.સ. ૧૮૬૮માં ભારતના વર્તમાન ઉત્તરપ્રેદેશ રાજ્યમાંથી મેળવાયું હતું.

"બર્ડલાઈફ ઈન્ટરનેશનલ કન્જર્વેશન શ્રુપ"ના સ્ટુઅર્ટ બુચાર્ટ જાણાવે છે : "૧૩૮ વર્ષો પછી એક મોટીચાંચ પાન-કરકરિયાનું મળી આવવું એ એક નોંધપત્ર બીજા છે. એ પછી તરત જ એનો બીજો નમૂનો પક્ષીશાસ્ત્રીઓની નજર તળે અનેક વાર પસાર થેયેલ નમૂનામાંથી મળી આવ્યો એ પણ ઓદ્ધું આશ્વયજનક નથી. આ રહસ્યમય પક્ષી બાબતે નહિયત માહિતી ઉપલબ્ધ છે."

આ જાતિ 'બર્ડ કન્જર્વેશન યુનિયને' બાદાર પાઠેલ ભયગ્રસ્ત વન્યજીવોના 'રેડ લેટા લિસ્ટ'માં 'અપૂર્ણતી માહિતી' (data deficient) તરીકે વર્ગીકૃત છે. આ વર્ગીકરણનો અર્થ એ છે કે તે જાતિ વિલુમ હોય, તેનું અસ્તિત્વ હોય પણ ખરું, કે તે ખૂબ જ ઓછી વ્યાપક હોય; પરંતુ તે બાબતે માહિતી ન હોય.

આ નવું એકાકી પક્ષી શોધાયાથી એ સાબિત થયું છે કે તેનું પ્રજનન થઈ રહ્યું છે. આ પરથી કહી શકાય કે તેની કયાંક, કેટલીક વસ્તી છે.

સ્રોત : www.birdlife.org (અનુ. શ્રી અશોક મશરૂ)

૧૧ સારસ પક્ષી દેખાઈ ગયાં.

અશોક મશરૂ

એ/૭, આલાપ એરીટેજ, સત્યસાંઈ હોટિલ પાસે, કાલાનાડ રોડ,
રાજકોટ ૩૬૦૦૧



અમદાવાદમાં પચરંગી શક્કરખોરાનો માળો

ઘણા સમય પહેલા ‘વિહંગ’માં અમદાવાદમાં
પચરંગી શક્કરખોરા (Purplerumped Sunbird)ની
હાજરી સામાન્ય બની રહી છે તેમ મેં લખેલું.

૧૦મી ફેબ્રુઆરી, ૨૦૦૭ના રોજ બપોરે હું મારા
ઘરમાં પહેલા માળો બેઠો હતો. ઘરનો ‘દેર બેલ’ વાગતા
હું બધાર બાલ્કનીમાં નીકળ્યો અને એક પક્ષીને મેં મારી
સામે પીળી કરેશ પર મારાથી પાંચેક કૂટ નીચે બેઠેલું જોયું.
સમય બપોરના સવા વાગ્યાનો હતો. સૂર્યના તાપમાં
પક્ષીના શરીરના ઉપરના ભાગે ચણકતો ‘મરુન’ રંગ,
માથા પરનો ચણકતો લીલો રંગ, ગળાનો જંબુલીયો રંગ,
છાતીનો પીળો ભાગ તથા શરીરની નાચેનો સંક્રદ ભાગ
પણ હું જોઈ શકતો હતો. ચણકતી ધાતુ જેવા ‘મરુન’,
લીલો અને જંબલી રંગો જોઈને હું રોમાંચિત થઈ ગયો
અને પક્ષીની સુંદરતા મેં મન ભરીને માણી. ‘સનબર્ડ’
નામ કેમ પર્યું હશે તે પણો તરત જ સમજાઈ ગયું!

આ દિવસે મેં નર પક્ષીને ગ્રાણ વખત જુદા જુદા સ્થળે
૧-૦૦ વાગ્યાથી ૪-૦૦ વાગ્યા સુધીમાં, બપોરના સમયે
અનુકૂળ સૂર્યપ્રકાશમાં જોયું. પરંતુ જેના પરથી તેનું નામ
પર્યું છે તે ડીંહુ (rump), હું વ્યવસ્થિત રીતે જોઈ શક્યો
નહીં. ૧૧ માર્ચના રોજ સવારે સાડાઓઠ વાગ્યે કરેશ પર
જોયો ત્યારે તે છાંચડામાં હતો તેથી તેની સુંદરતા, જે
તડકામાં દેખાતી હતી તેવી ન હતી.

૧૪મી માર્ચના રોજ સવારે પોણાઓઠ વાગ્યે ફરીથી
બોરસલી પર નર અને માદા બંને પક્ષીઓ સાથે જોયા.
ફરીથી તા. ૧૭મી માર્ચના રોજ બે વાગ્યે આસોપાલવ પર
નર જોવા મળ્યો. ત્યાર બાદ બપોરે આ પક્ષી પર નજર
રાખતા, એક માદા પક્ષીને મફાન તરફના ભાગે આસોપાલવ
પર જતાં જોયું. ત્યાં અચાનક જ માળા પર નજર પડી ગઈ.
આમ મને આ પક્ષીનો માળો મળી ગયો. માળામાં નીચેના
ભાગે બે સંક્રદ પદ્ધી લટકતી જોઈ શકતી હતી.

ગ્રાણ વખત નર પક્ષીને માળા પર જતાં જોયું. માદા
પક્ષી વારંવાર (લગભગ દર પાંચ મિનિટે) માળા પર
આવતું હતું. જ્યારે નર પક્ષી દર પંદર મિનિટે એક વખત
માળા પર આવતું હતું. મફાનની છત પર જઈને થોડો

સમય માળા સામે બેઠો ત્યારે ઘ્યાલ આવો કે હજુ માળો
ભનાવવાનું કામ ચાલુ હતું. પક્ષી કદાચ ચાંચમાં કરોળિયાતનું
જાણું લઈને માળો મફાન વાદાનું કામ કરતું હતું. ૧૮મીના
રોજ ઘણી વાર આ પક્ષી જોવા મળ્યું. આ પક્ષીનો માળો
૨૫ કૂટ જેટલી ઊંચાઈ પર હતો તે પણ એક અસામાન્ય
બાબત ગણાય, એમ હું માનું છું. શક્કરખોરા (Purple
Sunbird)ના માળા મેં ૮-૧૦ કૂટ જેટલી ઊંચાઈ પર
ઘરમાં તથા છોડ પર દોઢ ફૂટથી લઈ પાંચ કૂટ જેટલી
ઊંચાઈએ જોયા છે.

૨૮મીના રોજ બંને સંક્રદ પદ્ધીઓ માળામાં વડી
લઈ માળો પૂર્ણ કર્યો. આમ માળાની ગુંથણીનું કાર્ય પૂર્ણ
થયું હોય એમ લાગ્યું.


પી. એસ. કક્કર

૨૪, ન્યુ નંદનવન સોસાયટી, ઈસરો પાછળ, અમદાવાદ-૧૫



ચાંચિયો (Frigate bird)

જાનગરથી ૧૨ કિલોમીટર દૂર આવેલા
રણજીતસાગર તળાવે તા. ૨૪-૬-૦૭ના રવિવારે
પક્ષીનિરીક્ષણ માટે ગયેલ. વાતાવરણ વાદળાણ્યું હતું અને
સમય હતો મોડી સાંજનો (૬-૪૫). આકાશમાં ઉરી રહેલા
એક કાળા પંખી તરફ મારું ઘણા ખેંચાયું. આ પહેલા આવું



પંખી મારા જોવામાં કદી આવેલું નહીં. સાવ નવું લાગ્યું.
તેની પંખો લાંબી અને સાંકડી હતી, પૂછદી લાંબી અને
ઉંડા ખાંચાવાળી, ચાંચ પણ લાંબી અને છેંદેથી વળેલી હતી.
આ આકાર-પ્રકાર જોતાં તે વિશિષ્ટ પ્રકારનું પંખી જણાયું.

પ્રકાશ નહીં જેવો હતો છતાં મેં દૂર ઊરી જતા તે
પંખીના ફોટા પાડી લીધા. છાંચિયત્ર (silhouette) જેવા
એ ફોટા આવ્યા. પંખીની ઓળખ માટે મારા પક્ષીનિરીક્ષક
મિત્ર કુણાલ જોશીને તે બતાવ્યા. ગ્રિમેટની ફિલ્ડગાઈડનાં
ચિત્રો સાથે મારા લીધેલા ફોટા સરખાવતા તે પંખી,
ચાંચિયો (Frigatebird) લાગ્યું. ‘હેન્ડબૂક’ પ્રમાણે બે
જાતના ચાંચિયા ભારતમાં નોંધાયા છે, તેમાંથી આ ક્ષેત્રે
ચાંચિયો તે ખાતરીપૂર્વક કહી શકતું નથી. ‘હેન્ડબૂક’માં
જણાવ્યા પ્રમાણે ચાંચિયા, સમુદ્રનાં પંખી (Ocean birds)

હે. ડિન્હી મહાસાગરમાં, માડાગાસ્કરની ઉત્તરે આવેલ સેશેસ્સ અને અલ્ડાબ્રા ટાપુઓમાં તે પ્રજનન કરે છે. ભારત માટે તે અતિ વિરલ અથવા રખડુ (vagrant) પણી ગણાય. દરિયાઈ વાવાજોડામાં ક્યારેક આ તરફ જેંચાઈ આવે. થોડા વરસો પહેલા દક્ષિણ ગુજરાતના દરિયાકંઠે એક મરેલ ચાંચિયો મળેલ. આમ ગુજરાત રાજ્ય માટે ચાંચિયો દેખાયાનો આ બીજો બનાવ ગણાય.

નોંધ : ગુજરાતમાં ચાંચિયો આ પહેલા તા. ૮-૮-૧૯૮૬ના રોજ નોંધાયો હતો. શ્રી કર્મવીર ભણેને તાપી નદીના કંઠે ધાયલ અવસ્થામાં એક નાનો ચાંચિયો (Lesser Frigatebird) મળ્યો હતો. આ પક્ષીની ઓળખની પુષ્ટિ ‘બોઝે નેચરલ હીસ્ટરી સોસાયટી’ દ્વારા પણ થઈ હતી. શ્રી કર્મવીર ભણેની આ વિશેની નોંધ ‘ચાતક’ (Volume 4, Issue 11 & 12 : 39-40, 1986)માં પણ પ્રકાશિત થયેલી છે. આ માહિતી માટે ‘વિહંગ’ ડૉ. ભવભૂતિ પારાશર્યનું આભારી છે.

જ્યદેવ પટેલ

નવજીવન સોસાયટી, રામેશ્વરનગર, જીમનગર

વિકટોરિયા પાર્કમાં નાની સંતાકૂકડી
તા. ૩-૩-૦૭ના રોજ શ્રી મોહિતભાઈ અંધારિયા સાથે વિકટોરિયા પાર્કની મુલાકાત લીધી. તેમાં આવેલ તળાવડીમાં કુદરતની મહેરબાનીથી છેલ્લાં બે વર્ષથી ખૂબ પાણી છે. લોજનશાળાની પહેલાના ખાંચામાં એક નાણું આવે છે. ત્યાં પક્ષીઓ નિહાળતા હતો ત્યારે નાની સંતાકૂકડી (Baillon's Crake, Porzana pusilla) જોવા મળી. આ સંતાકૂકડીની વિકટોરિયા પાર્કમાં અને કદાચ ભાવનગરમાં પણ પ્રથમ નોંધ જ છે. આ અગાઉ મેં આ સંતાકૂકડીને તથા ૨૦૦૫ની સાલમાં મારા મિત્ર ડૉ. ઈન્ડ ગઢની સાથે ફેદરા-બગોદરાના રસ્તે એક નાળા પાસે તથા તા. ૧૪-૨-૦૭ના રોજ નળસરોવર ખાતે જોયેલ હતી.

કૃષ્ણકુંજ પર પક્ષીનિરીક્ષણ

તા. ૨૫-૨-૦૭ના રોજ વિકટોરિયા પાર્ક ખાતે આવેલ કૃષ્ણકુંજ તળાવડીમાં ૧૦૦ જેટલી સર્પશીવ (Darter) જોઈ. ત્યાં વચેટ કાજિયાં (Indian Shag) તથા મોટા કાજિયાં (Large Cormorant) પણ મોટી સંખ્યામાં રાતવાસો કરે છે. ત્યાંથી પાછા ફરતાં ચોટલિયો સાપમાર (Crested Serpent-Eagle) જોવા મળ્યો. તળાવડીની પાછળના રસ્તે એક મોટો કાળો રૂમસ (Greater Spotted Eagle)ને શેતશિર સમડી (Brahminy Kite)

ભગાડતી હતી તે જોવાની ખૂબ મજા પડી. ખરેખર, વિકટોરિયા પાર્ક પક્ષીનિરીક્ષણ માટે નાનકડા ભરતપુરની ગરજ સારે છે!

દર્શન અંધારિયા, કંદર્ઘ અંધારિયા
૮૮૦/બી, મહિલા કોલેજ પાછળ, ભાવનગર ૩૬૪૦૦૧

સારસ અને તુરમ્ભી

- **સારસ :** સ્થળ : થાન-વાંકાનેર વચ્ચે ટ્રેનમાંથી જોયેલ. તારીખ : ૨૮-૮-૦૭, સમય : ૩-૦૦ સાંજે, સંખ્યા : ૨.
- **તુરમ્ભી :** સવારે ૮ વાગ્યે કાઈસ્ટ કોલેજ, ચાજીકોટ પાસે એક તુરમ્ભી (Redheaded Falcon) વીજળીના થાંભલા ઉપર બિસ્કોલી ખાતું જોવા મળ્યું. તા. ૧-૬-૦૭.

રાજીવીપ જાલા
ચામનિવાસ, ૩૮/બી, મેઈન રોડ, પર્સિકી સોસાયટી, રાજકોટ - ૧

મોરબી પાસે રાખોડીશિર ગરુડ

તા. ૨૬-૧૧-૦૬ના રોજ હું, મારા ભાઈ રોહિત તથા કેટલાક મિત્રોની સાથે મોરબી પાસે આવેલ પાનેલી વીડીની મુલાકાત ગયો હતો. સમય બપોરના ચાર વાગ્યાનો હતો. વીડીમાં આવેલા એક નાના ચેક તેમ પાસે વૃક્ષોથી છવાયેલા વિસ્તારમાં અમને એક અપુષ્ટ રાખોડીશિર ગરુડ (Greater Greyheaded Fish-Eagle - *Ichthyophaga ichthyactus*) જોવા મળ્યું. અમને આ નિરીક્ષણથી ધ્યાન આશર્ય થયું. આ ગરુડનું પેટ સંકેદ હતું. અને તેની છાતી પર તથા માથા પર તૂટક રેખાઓ (streaks) હતી એની ચાંચ સંપૂર્ણપણે રાખોડી હતી અને તેના સાથણો (thighs) સંકેદ પીછાથી ઢાકેલી હતી. હું આ પક્ષીની તસવીર લઈ શક્યો, જેના આધારે એની નિશ્ચિત ઓળખ કરવાનું સરળ બન્યું. છેલ્લાં ત્રણ વર્ષથી હું આ વીડીની દરેક ઝતુમાં અવારનવાર મુલાકાત લઈ હું, પણ આ પક્ષી મેં ત્યાં પ્રથમ વાર જ નિદાયું. (આ નોંધ સાથે તે પક્ષીની તસવીરની એક નકલ મોકલી હોત તો તે વધારે ઉપયોગી થાત. - લા.)

તા. ૨૮-૧૨-૦૬ના રોજ વહેલી સવારે હું ફરીથી આ પક્ષીને શોધવા પાનેલી વીડી ગયો. પરંતુ આ વખતે એ દાણીઓચર થયું નહીં. જો કે આ મુલાકાતમાં ત્રણ થોડારિયા ગંદમ (Greynecked Bunting) જોવા મળ્યા.

પ્રસાદ ગણપુલે
પરશુરામ પોટરી વક્સ, નજરબાગ સેંચન સાંચે, મોરબી

કાબરનો કલકલાટ

અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના રમણીય

પરિસરની નજીક આવેલા અમારા બહુમાળી મકાનમાં છઢા માળે જરૂરમાં લગાવેલા ‘પક્ષીધર’માં આજે લગભગ દસેક વર્ષથી કાબરયુંનો (Common Myna - Pairs) અને કાનેક વાર માળા બાંધી ચૂક્યાં છે. આવા પક્ષીધર બાળકો માટેના પ્રકૃતિશિક્ષણ શિનિરમાં અમે બાળકો પાસે બનાવડાયું હતું. લાકડાના આ પક્ષીધરમાં અન્ય જગ્યાઓએ પણ ચકલી જેવાં પક્ષીઓએ (કયાં?) તેમ જ ખીસકોલીઓએ માળા બાંધ્યા છે.

કાબરોનો આ વસવાટ માનવજીવનમાં આનંદનો અને પ્રકૃતિ-સાન્નિધ્યનો ઉલ્લાસ ઉમેરવાનું કામ કરે છે. માળા બદલવાના સમય સિવાય અન્ય સમયે કાબરો પરિસરને સ્વચ્છ રાખે છે. ફક્ત માળો બદલે ત્યારે જૂના માળાની સામગ્રી પક્ષીધરની બહાર ફગાવીને કચરો વેરે છે. તે સિવાય ક્યાંય વિષા કે એઠવાડનું નામ નહીં. હા, કાબરના ‘ફ્રેડમાર્ક’ સમો કલખલાટ તો ખરો જ!

એક વિચિત્ર ટેવ જે સમજતી નથી તે આ કાબરો દ્વારા માળાની સામગ્રી તરીકે, કચરામાં ફંકાયેલ પ્લાસ્ટિક અને એલ્યુમીનિયમ ફોર્ટલ જેવા ફૂન્ઝિમ પદાર્થોનો વપરાશ! ગુટખા વગેરે પદાર્થોના ફેંકી દીધેલાં પરીકાં અને ચ્હાના પ્લાસ્ટિકના નાના ઘાલા પણ કાબરો લાવે છે! ઘાસ, પાંડાં, ડાળખીઓ વગેરે પદાર્થો સાથે આ પ્લાસ્ટિક જેવા પદાર્થો કાબરો શા માટે ભેળવતી હશે?

આવું જ એક નિરીક્ષણ કેટલાંક વર્ષો ઉપર થયું હતું. જેમાં, શક્કરખોરા (Purple Sunbird)એ તેના માળામાં, એક સંસ્થાનાં સૌર ઉર્જાના સાધનોમાંથી ‘ગ્લાસવૂલ’ લાભીને વાપર્યું હતું. જો કે, ગ્લાસવૂલના પ્રાદૂર્ધિક રૂ સાથેના સાધ્યને કારણે તેનો વપરાશ સમજી શકાય તેવો છે, પણ કાબરોનો પ્લાસ્ટિકપ્રેમ કેમ સમજવો? (રંગો પ્રત્યેનું આકર્ષણી!?) -લા.)

રાજેશ - સંધ્યા ભાઈ

૬૦૩, અનુરાગ, વિધાનગર સ્ક્વાર પાછળ, ઉસાનપુરા,
અમદાવાદ ૩૮૦૦૧૪

જામનગરમાં પક્ષીનિરીક્ષણ

જામનગરમાં પક્ષીનિરીક્ષણ વિશેની વાત કરીએ એટલે સ્વાભાવિક રીતે જામનગરની શાનસમા લાખોટા તળાવની વાત તો કરવી જ પડે! આમ તો જામનગરના લાખોટા તળાવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ સારી સંખ્યામાં પક્ષીઓ મહેમાન બનીને આવ્યાં હતાં. એટલું જ નહિ પરંતુ આ વર્ષ લાખોટા તળાવમાં ટીલિયાણી બતક (Spotbilled Duck), નાની સિસોટી બતક (Lesser Whistling Teal), ભગતકુ (Coot), નાની

દુલ્કી (Little Grebe) અને કાજિયા (Cormorants)ના માળા સારી સંખ્યામાં જોવા મળેલ હતા. ઉપરાંત, જામનગર જાતે લાંબા સમય પછી જિરજા (Cotton Teal) પણ જોવા મળી હતી.

ભાગ્યે જ જોવા મળતી ટપકીલી ચાંચ પેણ (Spotbilled Pelican) તા. ૧૪-૧-૦૭ના રોજ જામનગરની નજીક વિભાપર ગામ પાસે જોવા મળી. સંખ્યા-૮.

તા. ૨૮-૧-૦૭ના રોજ જામનગર નજીક રણાંત્ર-સાગર તેમની મુલાકાત મારા મિત્ર જય ભાયાણી સાથે લીધી હતી. ત્યાં આશરે ચાર વર્ષ પછી ધોળીઓંખ કારચિયા (White-eyed Pochard) જોવા મળેલી. તા. ૩-૨-૦૭ના રોજ ચટકી માખીમાર (Redthroated Flycatcher), પાનસુગરી (Blackthroated Weaver), લાલ ટ્યુસિયું (Red Munia), નીલકંદી (Bluethroat), રણપીછો (Desert Wheatear) જેવાં પક્ષીઓએ મારું અને મારા મિત્ર અન્ધિન નિવેદીનું સ્વાગત કર્યું હતું. રણાંત્રસાગર તેમની પાસે શેતપાંખ જલમાંઝાર (Pheasant-tailed Jacana)ના માળા પણ જોયા હતા. (સંખ્યા ૬). વળી, કાળો જલમાંઝાર (Bronzewing Jacana) પણ ધોળા લાંબા સમય પછી જામનગરનું મહેમાન બન્યો હતો. (ત્રીસેક વર્ષ પહેલાં એક કાળો જલમાંઝાર લાખોટા તળાવમાં એક મહિના સુધી જોયેલ. સૌરાષ્ટ્રમાં તે પ્રથમ દર્શન હતું. - લા.)

સૂરજ પી. જોખી

બી/૧/૧૭, ગવર્નમેન્ટ કોલોની, પ્રદર્શન આઉન્ડ, જામનગર

કચ્છમાં કેટલાંક અગત્યનાં નિરીક્ષણ.

પાણીની ધાનચીડી અને કાસ્પિઅન બાટણ

શ્રી ઊરી સોરેન્સન અને જે.કે.તિવારીએ તા. ૧૩-૨-૦૭ના રોજ બન્ધીના કાર વિસ્તારમાં પાણીની ધાનચીડી (Water pipit - Anthus spinoletta)નું તથા તા. ૧૪-૨-૦૭ના રોજ બન્ધીના હોડકા ઠઠ નામના જલખાવિત વિસ્તારમાં કાસ્પિઅન બાટણ (Caspian Plover - Charadrius asiaticus)નું નિરીક્ષણ કર્યું. ગુજરાત માટે આ પ્રથમ ‘ફોટોગ્રાફિક રેકૉર્ડ’ છે.

ધારી ઠંક પાસેના કાંટ વિસ્તારમાં ૬૦ જેટલી પાણીની ધાનચીડી ચાતવાસા (roosting) માટે આવતી જોવા મળી હતી. (શ્રી જુગલ તિવારીએ ફોટોગ્રાફ લીધેલ)

નાનો ટીસો

અત્યાર સુધીમાં ગુજરાતમાં કચ્છના નાના રણમાં

નાના ટીસા (Common Buzzard)ની એક માત્ર અપુષ્ટ નોંધ છે.

૨૦૦હના નવેમ્બરમાં જે.કે.તિવારી, ક્લેમેન્ટ ફાન્ડિસ અને જ્ય તથા વેન્ડીએ રાનાના ટીસા જોવા હતા તથા હોડકા ઠઠ, સેરવો હંદ, ભુજિયા અને જીવૌ વિસ્તારમાં તેની તસવીર પણ લીધેલ. ત્યાર બાદ, ફેબ્રુઆરી, ૨૦૦૭માં ઊઝી સોરેન્સન સાથે સારવો વિસ્તારમાં એક નાનો ટીસો જોવા મળેલ. ફેબ્રુઆરી ૨૦૦૭માં ઊઝી સોરેન્સને નાના રખમાં દસાડાની મુલાકાત લીધી ત્યારે ત્યાં પણ એક નાનો ટીસો તેમને જોવા મળ્યો હતો. ગુજરાતમાંથી પાંચ નાના ટીસાનો આ પ્રથમ, તસવીર સહિતનો ‘રેકર્ડ’ છે.

□ શિયાળુ રેત અભાલી

કૃષ્ણમાં - ગુજરાતમાં આ જીતિની માત્ર એક અપુષ્ટ નોંધ જ છે. ૧૯૪૩-૪૪માં પોતાનાં સર્વેક્ષણોમાં ડો. સલિમ અલીને આ પક્ષી મળ્યું નહોતું. પરંતુ તેમના ૧૯૪૫ના પુરુસક ‘બર્ઝ્સ ઓફ કૃષ્ણ’માં આ પક્ષીનો ઉલ્લેખ છે, કારણ કે ટેટલાક બ્રિટિશ પક્ષીનિરીક્ષકોએ ત્યાં સુધીમાં તેને જોયેલું.

કૃષ્ણના છારી હંદ, હોડકા ઠઠ, સેરવો હંદ, ભગડિયા હંદ અને વેકરિયા હંદ (હંદ અને ઠઠ બને કુદરતી જળવિસ્તારો માટે વપરાતા કચ્છી શાંદો છે.) વિસ્તારની આસપાસ ઓછામાં ઓછી ૫૦૦૦ શિયાળુ રેત અભાલી (Sand Martin, *Riparia riparia*) જોવા મળી હતી. આ પક્ષીઓ કાયમ સવાર અને સાંજના સમયે ક્રીટકો પકડવા માટે ઊડતાં જોવા મળતાં અને ઊંચા સાઈપેરસ (Cyperus) પ્રકારના ઘાસ જેવી લાગતી વનસ્પતિમાં તેમનો રાતવાસો રહેતો. આ જીતિની ઘણી તસવીરો લઈ શકાઈ હતી અને એમની હાજરીની યોગ્ય પુષ્ટિ થઈ હતી. એમના ગ્રતુમવાસના વિસ્તારમાં એ એક પરિવર્તન થયેલું ગણી શકાય કારણ કે, ઉત્તર ભારતમાં આ એક સામાન્ય યાયાવર પક્ષી હતું. આ વિસ્તારમાં શિયાળુ રેત અભાલીની આટલી મોટી સંખ્યા (૫૦૦૦ જેટલી)ની ખાસ નોંધ લેવાવી જોઈએ. ગુજરાતમાં તેમની તસવીર સાથેની આ પ્રથમ નિશ્ચિત નોંધ છે. શિયાળુ રેત અભાલી નવેમ્બરથી માર્ચના બીજા અઠવાડિયા સુધી જોવા મળી. વન-વિભાગ દ્વારા આપોજિત છારી હંદ ખાતેની પક્ષીગણતરી વખતે તેમાં ભાગ લેનારા તમામ પક્ષીનિરીક્ષકોને આ પક્ષી ૫૦૦થી વધુ સંખ્યામાં જોવા મળ્યું હતું. (રેત અભાલી, મેં સૌ પ્રથમ ૨૦૦૦માં નવાપરા, જિ. નર્મદામાં એક વોકળા પાસે જોઈ હતી. શ્રી લાલસિંહભાઈએ મને તેની ઓળખાણ કરાવી

હતી. નષ્ટસરોવર પક્ષીગણતરી વખતે ૨૦૦હના જ્ઞાન્ય. મહિનામાં તે સેક્ટોની સંખ્યામાં દેખાઈ હતી. સરોવરમાં ઉગેલાં ઘાસમાં વહેલી સવારે ઊડાઉિડ કરતી રેત અભાલીને મોટા ભાગના પક્ષીનિરીક્ષકોએ જોઈ હતી. શ્રી લાલસિંહભાઈએ ભૂતકાળમાં અનેક વાર સૌરાષ્ટ્રમાં તેને જોઈ છે. માટે શ્રી તિવારીએ જોયેલી મોટી સંખ્યા, કંઈ માટે પ્રથમ નોંધ કલી શકાય - ગુજરાત માટે નહીં. -સં) (‘Birds of Saurashtra’માં પણ તેનો ઉલ્લેખ નિયમિત ચોમાસુ અને શિયાળુ મુલાકાતી તરીકે લેખકે કરેલ છે. - લા.)

□ વન ભડકિયુ

ફેબ્રુઆરી ૨૦૦૭માં પિયોણી રોડ પર વન ભડકિયા (Jungle Bush-Quail)નો એક મૃત નમૂનો મળી આવ્યો હતો. શ્રી એસ.એન.વડુ અને શ્રી અશ્ચિન પોમલે સેન્ટર ફીર ઝેઝ્ટ એન્ડ ઓશન (CEDO)ની તેમની મુલાકાત વખતે આ નમૂનો નિયાળ્યો છે.

□ બાદશાહ શકરો

ફેબ્રુઆરી ૨૦૦૬માં લાલા ધોરડ અભયારણ્ય નજીક એક બાદશાહ શકરો (Eurasian Sparrowhawk), એક સાંધા (Spiny-tailed Lizard *Uromastur hardwickii*)નો આહાર કરતો જોવા મળ્યો. ગુજરાત માટે આ પ્રથમ તસવીરવાળો રેકર્ડ છે. શ્રી એસ.એન.વડુ અને શ્રી એ. એ. ઓ. લાંગાની અગાઉની બે નોંધની આ રીતે પુષ્ટિ થઈ. ત્યાર બાદ, એ અંગેની ત્રણેની સંયુક્ત નોંધ ‘ઈન્ડિયન બર્ઝ્સ’માં પ્રકાશિત થઈ છે.

બૈયાં ફરી આવી ગયાં આપણે દેશ

વૈયાં (Rosy Starling)ને મહદુંશે આપણાં નિવાર્તી પક્ષી કહી શકાય, કારણ કે તેઓ ભારતમાં ૮ થી ૧૦ મહિના ઝેટલો સમય વિતાવે છે. પ્રજનનાર્થે માત્ર ૨-૩ મહિના માટે તે ભારત બાધાર જાય છે. વૈયાં સામાન્ય રીતે મે મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી, કે તેથી થોડો વધુ સમય અહીં જોવા મળે છે અને પછી પ્રજનન માટે અહીંથી વિદ્યાય થાય છે.

કૃષ્ણમાં આ પક્ષીઓ વિપુલ સંખ્યામાં મુલાકાતે આવે છે - અથવા કહી શકાય કે રહેવા આવે છે. પીલુ કે ખારી જાર (Salvadora persica)નાં ફળ એમનો પ્રિય ખોરાક છે. રણવિસ્તારમાં, બનીમાં અને કૃષ્ણમાં વગભગ બધે જ આ વૃક્ષ જોવા મળે છે. વૈયાં માટે આ વૃક્ષનું વાવેતર અને સંરક્ષણ જરૂરી છે.

પીલુ ઉપરાંત વૈયાં, વડની જાતનાં (*Ficus*) વૃક્ષોનાં

ફળનો આહાર પણ કરે છે; ખાસ તો વડ (Ficus bengalensis), પીપળો (Ficus religiosa) વગેરેના.

વૈયાં ફરી કચ્છમાં આવી ગયાં છે. ૨૦૦૭ના શ્રીધ બાદ પ્રથમ વાર તેમને રૂફ જુલાઈના રોજ અબડાસા તાલુકાના બીટા ગામ ખાતે જોયાં.

એ ઉપરાંત કાશ્મીરી ચાખ (European Roller) પણ આવી ગયાં છે. તેમનું આ ઋતુનું પ્રથમ દર્શન તા. ૨૮ જુલાઈના રોજ પિયોણી મહાદેવ મંદિર ખાતે થયું.

જુગલકિશોર તિવારી
સેન્ટર ફોર ઓશન એન્ડ ડેવલ
મોરી વિરાસી, તા. નાખત્રાણા, કચ્છ-ગુજરાત

ગીધ પર જાપતો

તા. ૨૮-૭-૨૦૦૭ના રોજ સવારના ૮-૩૫ વાગ્યે અમદાવાદથી પ્રાંગંધ્રા જતાં પ્રાંગંધ્રાથી દોઢેક ડિમી. પહેલાા, પ્રાંગંધ્રા અને સામાન્યિયાળીના રસ્તા ફંટાય છે, તે સ્થળ નજીક ૩૭ સફેદપીઠ ગીધ (Whitebacked Vulture) જોયાં. આમાંથી ૨૧, ખેડેર જેવી ઓરરી પર બેંકાં હતાં, જ્યારે ૧૫ નીચે પેલા શબ (caracass) પર હતાં.

તૈતન્ય નિમાવત

બ્લોક ૭૦૩/૪, ઘ-૧, સેક્ટર ૮, ગાંધીનગર ૩૮૨૦૦૮


સફેદપીઠ ગીધ (Whitebacked Vulture)

તા. ૨-૨-૦૭ના રોજ મોરબી ખાતે થયેલ એક માત્ર માળમાં એક સુંદર બચ્ચું અને એક પુષ્પ પક્ષી જોયું. સાથે શ્રી ભૂષણ પંજ્યા તથા શ્રી ભાવેશ નિવેદી હતા. ફરી તા. ૮-૪-૦૮ના મોરબી પાસે મધ્યુ-૨ બંધ પાસે નદી કાંઠેની

વીડી, જ્યાં તેની ખોરાક લેવાની જગ્યા છે, ત્યા ચકરાવા લેતું ૧ ગીધ જોયું. તે જ દિવસે સાંજે પોલીસ કવાર્ટસવાળા માળમાં

તો મોટું બચ્ચું અને બીજું પાંચ ગીધ પણ રાતવાસા (roosting)માં આવેલ હતાં. આ નિરીક્ષણ વખતે 'મધ્યર નેચર કલબ'ના શ્રી નરેન્દ્ર દોશી તથા શ્રી મારુતિ સાહેબ સાથે હતા. અમે ત્યા રહેતા લોકોને તથા બાળકોને ગીધનું મહત્વ સમજાયું તેમજ, નેચર કલબ, સુરત દ્વારા બધાર પેલ પુસ્તિકા આપી.

અશોક મશરૂ
અ/૭, આલાપ ડેરીટેજ, સત્યસાઈ હોસ્પિટલ પાસે, કાલાવાડ રોડ,
રાજકોટ ૩૬૦૦૦૧



વર્ષ ૨૦૦૭ માટેનો પ્રતિષ્ઠિત 'ઈ.ઓ.વિલ્સન નેચરાલિસ્ટ એવોર્ડ' શિકાગો યુનિવર્સિટીમાં જીવવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે કાર્યરત ડૉ. ટ્રેવર પ્રાઈસને એનાયત કરાયો છે. ડૉ. ટ્રેવર પ્રાઈસે ગાલાપાગોસ ટાપુઓના 'ડાર્વિન ફિન્ચ' પક્ષીઓ પર પીએચ.ડી. કર્યું છે.

પ્રો. પ્રાઈસ છેલ્લાં ત૦ વર્ષથી ભારતીય પક્ષીઓના ઉત્કાન્તિવિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છે અને તે વિષેના તેમના સંશોધનાત્મક લેખો અધિમ આંતરરાષ્ટ્રીય 'જર્નલો'માં પ્રકાશિત થયેલ છે. તેમનું અભ્યાસકેત્ર સમગ્ર ભારત રહ્યું છે, ખાસ તો તેમણે પૂર્વ ઘાટ, મુંદુકુર, મહાબળેશ્વર અને હિમાલય વિસ્તારમાં વ્યાપકપણે કામ કર્યું છે. છેલ્લાં ૨૦ વર્ષથી તેઓ હિમાલયનાં પક્ષીઓની જીતિ-પ્રજીતિ ઉદ્ભબની તરાફ (pattern). આ વિષય અંગે મોટા ભાગનું કામ એક જ ગોત્ર - પાન ફૂટ્કી (Phylloscopus Warbler)પર થયું છે. આ પક્ષીઓ હિમાલયમાં અને એશિયાના સમશીતોષ્ણ ભાગમાં પ્રજનન કરે છે અને શિયાળો ગાળવા ઉષ્ણકટિબંધીય એશિયામાં જીય છે. પ્રો. પ્રાઈસ આ નમૂના (model)નો અભ્યાસ કરી વિવિધ પંદેમાં જીતિ-પ્રજીતિના ઉદ્ભબ વિશે સંશોધન કરી રહ્યા છે.

હાલમાં તેમના સંશોધનનો ખાસ વિષય જીતિ-પ્રજીતિ ઉદ્ભબની પ્રક્રિયામાં જીતીય પસંદગી (sexual selection) તથા નૈસર્જિક પસંદગી (natural selection)નું મહત્વ એચે. તે ઉપરાંત, તેઓ બે મુખ્ય 'પોંઝેક્ટ' પર કામ કરી રહ્યા છે; વાણનોટર્ચિ આગંતુક (invasive)પક્ષીઓને શહેરી આવાસમાં સફળતાપૂર્વક સ્થાપિત કરનાર પરિબળો; તથા હિમાલય વિસ્તારનાં પક્ષીઓની જીતિ-પ્રજીતિ ઉદ્ભબની તરાફ (pattern). આ વિષય અંગે મોટા ભાગનું કામ એક જ ગોત્ર - પાન ફૂટ્કી (Phylloscopus Warbler)પર થયું છે. આ પક્ષીઓ હિમાલયમાં અને એશિયાના સમશીતોષ્ણ ભાગમાં પ્રજનન કરે છે અને શિયાળો ગાળવા ઉષ્ણકટિબંધીય એશિયામાં જીય છે. પ્રો. પ્રાઈસ આ નમૂના (model)નો અભ્યાસ કરી વિવિધ પંદેમાં જીતિ-પ્રજીતિના ઉદ્ભબ વિશે સંશોધન કરી રહ્યા છે.

સ્રોત : યુનિ. ઓફ શિકાગોની વેબસાઈટ home.uchicago.edu (અનુ. અશોક મશરૂ)

ઉત્તર ગુજરાતનાં જગ્યાશયો - ભાગ ૨

સાબરકાંઠાનાં જગ્યાશયો

ડૉ. પી. એસ. ટક્કે

જગ્યાશયોની દિલ્લિએ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લો ખૂબ જ અગત્યતા ધરાવે છે. અહીં પક્ષિસૂચિની વિવિધતા પડી સારી છે. નાઈઓ, તળાવો તથા સિંચાઈ યોજનાઓને લીધે સર્જયેલ જગ્યાશયો ઉપરાંત, અહીં જંગલ વિસ્તાર તથા ખેતી-વિસ્તાર સારો હોવાથી આ વૈવિધ્ય જોવા મળે છે.

સાબરકાંઠાનો પ્રદેશ ૧૯૪૮ સુધી મહીકાંઠા એજન્સીનો ભાગ ગણવામાં આવતો હતો. મહી નદી આ વિસ્તારમાં વહેતી ન હોવા છતાં ૧૯૪૮માં આ વિસ્તારને મહીકાંઠા નામ આપવામાં આવ્યું હતું, જે અસંગત હતું. સામાજિક કાર્યકરોના વિરોધના કરણે તેનું નામ પાછળથી ૧૯૪૮માં સાબરકાંઠા રાખવામાં આવ્યું. ૧૯૪૮ના ઓગષ્ઠ મહિનામાં ઈડર, મોહનપુર, વિજયનગર, સાઠેબા અને આંબલિયારા જેવાં ૨૮ જેટલાં સ્વતંત્ર રાજ્યો તેમજ અહુમદનગર, બોલુન્દ્રા, હાપા, કડોલી અને ડાભા જેવાં મહીકાંઠાનાં પરગણાઓનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો. આ ઉપરાંત અમદાવાદ, ખેડા, મહેસાણા અને પંચમહાલ જિલ્લાનાં કેટલાંક ગામો તેમાં ભેણવીને સાબરકાંઠા જિલ્લાની રચના કરવામાં આવી.

સાબરકાંઠા જિલ્લાની ઉત્તરમાં તથા પૂર્વમાં રાજસ્થાન રાજ્યનો વિસ્તાર આવેલો છે. પશ્ચિમ દિશામાં બનાસકાંઠા તથા મહેસાણા જિલ્લાના વિસ્તારો આવેલા છે. પશ્ચિમ દિશામાં સાબરમતી નાઈ, સાબરકાંઠા જિલ્લાને બનાસકાંઠા તથા મહેસાણા જિલ્લાથી અલગ કરી હઠ બનાવે છે. દક્ષિણ દિશામાં ગાંધીનગર, ખેડા અને પંચમહાલ જિલ્લાનો વિસ્તાર આવેલો છે. પૂર્વમાં અને ઉત્તર પૂર્વમાં થોડા ભાગમાં અરવલ્લીના કુંગરાઓની હારમાળા રાજસ્થાન સાથે તેની હઠ બનાવે છે.

‘ગુજરાત સ્ટેટ ગેઝેટીયર’ (૧૯૭૩) પ્રમાણે જિલ્લાનો વિસ્તાર ૭૩૬૪ ચો.કિ.મી. જેટલો છે. જ્યારે સેન્સસ ઓફ ઇન્દિયા (૧૯૮૧) પ્રમાણે સાબરકાંઠા જિલ્લાનો વિસ્તાર ૭૩૮૦ ચો. કિ.મી. જેટલો છે.

સાબરકાંઠા જિલ્લો નાઈઓની દિલ્લિએ સમૃદ્ધ છે. સાબરમતી, મેશ્યો, માઝુમ, વાત્રક, શેઢી, હાથમતી અને હરણાવ જેવી નાઈઓમાં બારે માસ પાણી રહે છે તેથી તે બારમાસી નાઈઓ છે. વળી ઈન્દ્રાસી, ખારી, સાઈ, ગુહાઈ, વાકળ, વેકરી, દેખોલ, ભેકાઈ, સકરી, બુધેલી, કોસંભી અને વારાંસી વગેરે નાની નાઈઓ પડી આ જિલ્લામાં આવેલી છે.

સાબરકાંઠા જિલ્લાનો ભૂતકાળ ઘણો ભવ્ય હશે તેમ લાગે છે. અહીં દેવની મોરી - મેશ્યો જગ્યાશય પાસે બૌદ્ધ સ્તુત હતો. સાબરકાંઠા જિલ્લાનો સંબંધ ભૂતકાળમાં સરસ્વતી નાઈ સાથે હતો તેમ પડી કહી શકાય. સ્વ. શ્રી મહિબાઈ દ્વિવેદીએ લખેલ મૈત્રકકાલિન ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના વિસ્તારને શબ્દપ્રદેશ કહ્યો છે અને તેને સરસ્વતી નાઈ સાથે સંબંધ હતો, તેમ લખ્યું છે. કુદ્રામન બીજાના શિલાલેખમાં આનો ઉલ્લેખ છે. આમ પ્રાચીન સમયમાં જો કોઈ મોરી નાઈનું વહેણ આ વિસ્તારમાં હોય તો તેની નિશાનીરૂપ ખારા પાણીનાં તેમજ મીઠા પાણીનાં સરોવરો અવશેષરૂપ આ વિસ્તારમાં હોઈ શકે. ખારા તળાવ (ખારા દેવિયા), ખારા તળાવ (નનાનપુરા) તથા ખારી નાઈ કદાચ સરસ્વતી નાઈના અવશેષરૂપ નિશાનીઓ હોઈ શકે.

મીઠા પાણીનાં તળાવો, કુડ અને વાવ પણ આ જિલ્લામાં મોરી સંઘામાં છે. ઈડરની આસપાસ રાડીસર, રણમલસર, પારસર અને ફટાહ તળાવ; દાવડમાં હર્ષલેસર; વડાલીમાં લાખેરા અને સામલેસર તથા શામળાજીમાં કરંબુજ જૂના સમયનાં તળાવો છે, તેમ ‘ગેઝેટીયર’માં જણાવ્યું છે.


૧૯૭૩-૭૪ સુધી મધ્યમ સિંચાઈ યોજનાના ભાગ રૂપે આ જિલ્લામાં મેશ્યો, ઈન્દ્રાસી તથા હાથમતી એમ નાચ નાઈઓ પર બંધ બાંધવામાં આવ્યા હતા. સમય જતાં લગભગ બધી બારમાસી નાઈઓ પર બંધ બાંધવામાં આવ્યા. આથી સાબરકાંઠા જિલ્લામાં સિંચાઈના વિસ્તારમાં પણ વધારો થયો.

વાત્રક, માઝુમ, મેશ્યો, હાથમતી, હરણાવ, ગુહાઈ, ઈન્દ્રાસી તથા સાબરમતી જેવી નાઈઓ પર નાના મોરા બંધ બાંધવામાં આવ્યા. સાબરમતી નાઈ પર ધરોઈ બંધ, ગુહાઈ નાઈ પર ગુહાઈ બંધ, ઈન્દ્રાસી નાઈ પર ઈન્દ્રાસી બંધ, હાથમતી નાઈ પર હાથમતી બંધ, માઝુમ નાઈ પર માઝુમ બંધ, મેશ્યો નાઈ પર મેશ્યો બંધ, વાત્રક નાઈ પર વાત્રક બંધ બાંધવાથી સિંચાઈ જગ્યાશયો તૈયાર થયા છે, જેમાંથી નહેરો કાઢી સિંચાઈ કરવામાં આવે છે. તે જ રીતે હરણાવ નાઈ પર હરણાવ-૧ અને હરણાવ-૨ સિંચાઈ યોજનાઓ શરૂ કરવામાં આવી છે.

સાબરમતી નાઈ પર મહેસાણા જિલ્લાના ખેરાળ તાલુકાના ધરોઈ ગામ પાસે બંધ બાંધવામાં આવ્યો છે. નાઈના તળથી બંધની ઊંચાઈ આશરે ૪૫ મીટર જેટલી

ઉત્તર ગુજરાતનાં જળાશયો

હે. આથી નદીના ઉપરવાસમાં ૧૦૭ ચો.ક્ર.મી. જેટલા વિસ્તાર સાબરકાંઠા જિલ્લામાં આવેલો હે. આ જળાશય વિસ્તારમાં જળાશયનું સર્જન થયું હે. બંધ મહેસૂસથા ઉત્તરમાં એડબ્રિઝાથી આગળ શામળાછના ગઢા સુધી જિલ્લાના ધરોઈ ગામ પાસે હે, પરંતુ જળાશયનો મોટો ફેલાયેલો હે. આ બંધનું કામ ૧૯૭૧માં શરૂ કરવામાં આવ્યું



ઉત્તર જીજાનાં જણાશાયો

હતું. ૧૮૮૮ના રિપોર્ટમાં તેનું બાંધકામ ચાલુ હતું, તેવું જણાયું છે. આમ ૧૮૮૮ બાદ તેનું બાંધકામ પૂર્ણ થયું હશે. આવા માનવસર્જિત જળાશયોમાં શરૂઆતનાં વર્ષોમાં પક્ષીઓની સંખ્યા જોવા મળતી નથી, પરંતુ હું એમ માનું છું કે ચાર પાચ વર્ષમાં જળાશયના વિસ્તારમાં જલીય વનસ્પતિ તથા માછલીઓ સારી એવી સંખ્યામાં તૈયાર થઈ જતાં ખોરાકની ઉપલબ્ધિને લીધે પક્ષીઓ આવી પહોંચતાં હશે.

ધોરોઈ ડેમ પર એમ મુખ્ય ડેમ પર તથા ત્યાંથી પૂર્વમાં બાબસર પાસે ડાઈક નં. ૨ પર પક્ષીનિરીક્ષણ માટે જતા. આ સિવાય વડાલી-બેડાલા રોડ પરથી પણ્ણિમાં વળી જઈને દેલવાડું કંપા પર તથા બેડાલાથી આગળ જઈ પણ્ણિમ દિશામાં વળી શામળાજીના ગઢા સુધી પક્ષીનિરીક્ષણ માટે તથા પક્ષીગણતરી માટે જતા.

વાત્રક નદી પર વાત્રક ડેમ માલપુર તાલુકાના પહાડિયા ગામ પાસે બાંધવામાં આવ્યો છે. નદીના તળથી ડેમ ની ઊંચાઈ આશરે ૪૩ મીટર જેટલી છે. આ બંધના કારણે લગભગ ૪૫ ચો.ડિ.મી. જેટલા વિસ્તારમાં જળાશયનું સર્જન થયું છે. વાત્રક સિંચાઈ જળાશય પર એમ જૂના સાતરડા (જે ગામ દૂબમાં ગયું છે) જતા હતા. ત્યાર બાદ, માલપુર પાસે રોડ પરથી બંને તરફ પક્ષીનિરીક્ષણ કરતા હતા અને ત્યાંથી પૂર્વમાં લુણાવાડા તરફ જઈ બે-ગાણ ગામ પાસેથી આ જળાશય પર પક્ષીનિરીક્ષણ કરતા હતા.

માઝુમ નદી પર મોડાસા તાલુકાના વોલ્વા ગામ પાસે બંધ બાંધવામાં આવ્યો છે. મોડાસાથી સાયરા થઈ વોલ્વા ગામ પાસે બંધ પહોંચી શકાય છે. નદીના તળથી બંધની ઊંચાઈ આશરે ૨૮ મીટર જેટલી છે અને આ બંધના કારણે આશરે ૧૩ ચો.ડિ.મી. જેટલા વિસ્તારમાં જળાશયનું સર્જન થયું છે. અહીં એમ વોલ્વા ગામં પાસે બંધ પર પહોંચી ડાબી તરફ જતા હતા. ત્યાર બાદ મેઘરંગ રોડ પર જઈ પણ્ણિમ દિશામાં ડાબી તરફ બંધના પાણા

પરથી પક્ષીનિરીક્ષણ કરતા હતા.

એકાદ વખત એમે માલપુરથી મેઘરંગ તરફ પણ ગયા હતા અને રસ્તામાં સિંગાપોર ગામના તળાવ પર ગયા હતા. આ તળાવ ધણું મોટું અને પક્ષીસૃષ્ટિની દણિએ ધણું સમૃદ્ધ કહી શકાય તેવું છે.

મેશ્યો નદી પર શામળાજી પાસે મેશ્યો બંધ બાંધવામાં આવ્યો છે. બંધની ઊંચાઈ નદીના તળથી ૧૪ મીટર જેટલી છે. આ બંધના કારણે ઉપરવાસમાં ૧૧ ચો.ડિ.મી. જેટલા વિસ્તારમાં જળાશયનું સર્જન થયું છે. હાથમતી નદી પર એમે મૂળ જળાશય પર, બામળા ગામ પાસે તથા વંકાનેર તરફના કાંઠેથી પક્ષીનિરીક્ષણ તથા પક્ષીગણતરી માટે જતા.

હરણાવ નદી પર વિજયનગર તાલુકાના છાપરા પાસે એક બંધ બાંધવામાં આવ્યો છે, જે હરણાવ-૧ના નામે ઓળખાય છે. બીજો એક બંધ વિજયનગર તાલુકાના વણજ ગામ પાસે બાંધવામાં આવ્યો છે. આ બંધ હરણાવ-૨ થથવા વણજ ડેમ ના નામે ઓળખાય છે. વણજ ડેમની ઊંચાઈ નદીના તળથી લગભગ ૪૨ મીટર જેટલી છે અને આ બંધના કારણે નદીના ઉપરવાસના ભાગમાં આશરે ૩ ચો.ડિ.મી. જેટલા વિસ્તારમાં જળાશયનું સર્જન થયું છે. અમે વણજ ડેમ પર પક્ષીનિરીક્ષણ માટે જતા અને ત્યાંથી વિજયનગર તળાવ પર પણ જતા.

ગુહાઈ નદી પર હિંમતનગર તાલુકાના ખંડિયાલ ગામ પાસે ગુહાઈ બંધ બાંધવામાં આવ્યો છે. બંધની ઊંચાઈ

ચાખ સ્વભાવે છે અન્તિ સૌંઘ્ય. નિરુપદ્રવી. જાગો કલબલાટ કરવાની ટેવ પણ નાણ. માત્ર એનો આ સંયમ છૂટી જાય છે શીતકાળમાં. કેબ્લુઆરી એનો સંવનનકાળ. એ પ્રસંગે ચાખનો ઉન્માદ અંગબ તરેણનો હોય છે. સૂર્યોદય તાજો જ થયો હોય એવે વખતે, એ પાંખો પર ઊંચે ઊડે છે. પચીસ ગ્રીસ ફિટ ઉપર ચડ્યો કે ત્યાં જ અટકી પાછો હેઠે ઊતરવા માડે છે. પણ સીધેસીધો નહિ પણ શુલાટ ખાતો, જિરિ કરતો. થોડું પણ્યો કે તરત જ કણ લઈને પાછો ઊંચે ચેડે છે અને ફરી પાછો ગુલાંટ પર શુલાંટ ખાતો હેઠે આવે છે. આ વખતે એના શરીરવર્ણની વાદળી ભભક્યી આખું વાતાવરણ રંગાઈ જાય છે. એની આમ શુલાંટ ખાવાની (rolling)ની ટેવને લીધે જ એનું નામ 'Roller' પડ્યું છે.

કારિનારાયણ આચાર્ય 'વનેચર'
'વનવગડાના વાસી' માંથી સાભાર (ચયન : નંદિતા મુનિ)

નદીના તળથી લગભગ ૪૩ મીટર જેટલી છે. આ બંધના કારણે નદીના ઉપરવાસમાં લગભગ ૧૩ ચો.કી.મી. જેટલા વિસ્તારમાં જળાશયનું સર્જન થયું છે.

ઈંડ્રાસી નદી પર ઈંડ્રાસી બંધ બાંધવામાં આવ્યો છે. અહીં અમે બિલોડાથી દક્ષિણમાં ભવનાથ મંદિર પર જઈ અને પશ્ચીનિરીક્ષણ તથા પશ્ચીગણાતરી કરતા હતા.

આમ સાબરકાંઠા જિલ્લામાં મુખ્ય બારમાસી તથા અન્ય નાની નદીઓ પર બંધ બાંધી સિંચાઈ મારે જળાશયોનું સર્જન કરવામાં આવ્યું છે. આ માનવસર્જિત જળાશયો ઉપરાંત નાનાં મોટાં અન્ય જળાશયો પણ સાબરકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં છે. અગાઉના લેખમાં હું જળાવી ગયો છું. તે પ્રમાણે, રીબા, ઘનસુરા, લીલોઈ, ગઢોલા,

ફૂટો, વડાલી જેવાં તળાવો ઘણાં છે. આ ઉપરાંત કુદરતી તળાવોમાં ખારા તળાવ (નનાનપુરા) તથા ખારા તળાવ (ખારા દેવિયા)નો સમાવેશ થાય છે. પ્રાંતિક પાસે નદીમાં બોખનો વિસ્તાર પણ પશ્ચીનિરીક્ષણ માટે સારો કહી શકાય. બારમાસી નદીઓ પર બાંધેલા બંધના કારણે મોટા વિસ્તારમાં જળાશયનું સર્જન થતું હોવાથી આવા સરોવર પર ત્રણથી ચાર જુદા જુદા સ્થળ પર પશ્ચીનિરીક્ષણ માટે જઈ શકાય છે.

આમ સાબરકાંઠા જિલ્લામાં સિંચાઈ માટેના જળાશયોની મોટી સંખ્યા તથા સિંચિત બેતીના મોટા વિસ્તારો હોવાથી પશ્ચીસૃષ્ટિનો સમૃદ્ધિ સારી જોવા મળે છે.

૨૪, નું નંદનવન સોસાયરી, ઈસરો પાછળ, અમદાવાદ-૧૫

કૃષ્ણમાં મરણતી લટોરા

જુગલકિશોર તિવારી

ભારતીય ઉપમહાદીપમાં મસ્કતી લટોરા (Grey Hypocolius, *Hypocolius ampelinus*)ની પ્રથમ નોંધ તત્કાલિન સિંધ અને હાલના પાડિસ્તાનના લારકાના જિલ્લામાં ૧૮૭૫ની હૃદી માર્યના રોજ બ્લેનફર્ડ દ્વારા કરવામાં આવી. બીજી નોંધ ૧૮૭૭ની રોજ બ્લેનફર્ડ દ્વારા વર્તમાન પાડિસ્તાનના બલુચિસ્તાન પ્રદેશમાં આવેલ કલાત નામના સ્થળેથી જ્યુકની છે. આ પછી છેક ૧૮૭૦માં ડો. સલીમ અલીએ ૧૪ નવેમ્બર ૧૮૭૦માં મહારાષ્ટ્રના કોલાબા જિલ્લામાં ક્રીલિમ ખાતે આ પશ્ચીની નોંધ કરેલ. આ પછી ફરી એક લાંબા અવકાશ બાદ કર્યાના મોટા રણમાં કુઝાર બેટ ખાતે શેખર દ્વારા ૨૨ અને ૨૩ માર્ચ ૧૮૭૦ના રોજ મસ્કતી લટોરાની નોંધ થઈ. (તે જ બેટ પર ૨૦૦૦માં શ્રી કેતન ટાટુએ તેની નોંધ કરી હતી. -સં.)

૨૩ જાન્યુઆરી, ૧૮૭૦ના રોજ ફૂલાય ગામ ખાતે શાંતિભાઈ વરુ દ્વારા એક માદા મસ્કતી લટોરાની નોંધ લેવામાં આવી. ત્યાર બાદ, 'બોખે નેચરલ લિસ્ટરી સોસાયરી'ની ટીમ દ્વારા એક્સાયિક વાર આ પશ્ચીની નોંધ કરવામાં આવી અને વિગતવાર અભ્યાસ પણ કરવામાં આવ્યો. મસ્કતી લટોરાની સર્વાધિક સંખ્યાનું નિરીક્ષણ ૨૦ ડિસેમ્બર, ૧૮૭૮માં જે.કે.તિવારી, શાંતિભાઈ વરુ અને મ.કુ. શ્રી હિંમતસિંહજાએ કર્યું હતું, જેમાં ત જૂથમાં વહેયાયેલાં કુલ ૧૫૦ પશ્ચીઓ નોંધાયેલાં. તાજેતરમાં ૨૪ માર્ચ ૨૦૦૭ના રોજ ફૂલાય ખાતે કુલ ૧૭૫ પશ્ચીઓ નંધાયેલા જે વળતા જ્ઞતુપ્રવાસ માટે એકઠાં થયાં હશે તેવું અનુમાન થઈ શકે. નવેમ્બર ૧૮૮૦ પછી દરેક શિયાળામાં

મસ્કતી લટોરા નોંધાયા છે. આ પરથી એમ કહેવું અસ્થાને નહીં ગણાય કે મસ્કતી લટોરા કર્ષણમાં નિયમિત શિયાળું મહેમાન છે.

મેં, કર્ષણમાં મુખ્યત્વે છેલ્લાં બે વર્ષ દરમ્યાન (૨૦૦૫ના નવેમ્બરથી ૨૦૦૭ના એપ્રિલ મહિના સુધી) મસ્કતી લટોરાનું નિરીક્ષણ કર્યું. આ નિરીક્ષણો ફૂલાય ગામ પાસેની કાંટ (scrub forest) અને છારી ઢેંડ જળપાલવિત વિસ્તારના કાંઠાં નજીક આવેલા વોચ ટાવર નં. ૧ની આસપાસ, જુદી જુદી ૫૦થી ૮૦થી પણ વધુ મુલાકાતો દરમ્યાન કરવામાં આવેલ. બહુ દુભ્યાંની વાત એ છે કે, મસ્કતી લટોરાનો આ આવાસ હવે કોલસામાં બદલાઈ ગયો છે! (કેમ કે ગેર-કાયદેસર રીતે કોલસો પાડવા કાંટનાં જંગલ કર્યાઈ રહ્યાં છે.)

૨૦૦૫માં પભી નવેમ્બરના રોજ આ પશ્ચીનું આગમન થયું અને તેણે ૨૦૦૬ની હૃદી એપ્રિલ સુધી અહીં રોકાણ કર્યું. આ ઋતુ દરમ્યાન તેમની મહત્તમ સંખ્યા ૭૦ની જોવા મળી હતી. ૨૦૦૬માં ૧૭મી ઓક્ટોબરથી ૨૦૦૭ની ૧૫મી એપ્રિલ સુધીના સમયગાળા દરમ્યાન મહત્તમ ૧૭૫ પશ્ચી જોવા મળ્યા હતાં. મસ્કતી લટોરાના રોકાણનો આધાર ખોરાકની ઉપલબ્ધ પર છે (અને ખોરાકની ઉપલબ્ધ ચોમાસાની પરિસ્થિતિ પર આધારિત છે) એવું કહી શકાય. ૨૦૦૬માં ચોમાસું ૬૦૦ મિલી વરસાદ સાથે સારું વીત્યું હતું અને મસ્કતી લટોરા ફૂલાય ખાતે હ મહિનાથી પણ વધુ સમય સુધી રોકાણ હતા.

જાન્યુઆરી ૧૮૮૦થી એપ્રિલ ૧૮૮૪ સુધી લેખક

તથા અન્ય નિરીક્ષકોએ મસ્કતી લટોરાના આગમન અને વિદ્યાય અંગે એકનિત કરેલી માહિતી અનુસાર, તેનું વહેલામાં વહેલું આગમન નવેભરમાં જોવા મળેલું. એની વિદ્યાય પર દસ્તિપાત કરીએ તો, મસ્કતી લટોરા ૧૯૮૪માં ઉ એપ્રિલ સુધીના લાંબા સમય માટે અહીં રોકાયા હોવાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે (લેખકે ઓરિએન્ટલ બર્ડક્લબના નાઈજેલ લિન્સી સાથે કરેલું નિરીક્ષણ). આ પરથી એવું નિઃશંક રીતે કહી શકાય કે, મસ્કતી લટોરા ફૂલાયની કાંટમાં ઓકટોબર-નવેભરમાં આવે છે અને માર્ચ-એપ્રિલ સુધી રોકાય છે. કુલ ૧૮ વર્ષની નિરીક્ષણ નોંધના આધારે કહી શકીએ કે, મસ્કતી લટોરા કચ્છના ફૂલાય ગામની કાંટમાં નિયમિત શિથાળુ મુલાકાતી છે.

ફૂલાય સિવાય અન્ય સ્થળે આ પક્ષી બે-ગ્રાસ વાર નોંધાયું છે. એક નોંધ, હ માર્ચ ૧૯૮૪ના રોજ માંડવી નાંદુના દરિયાકાંઠે આવેલ લાયજ ખાડી ખાતે કરવામાં આવી હતી. બીજી નોંધ, લખપત કિલ્વાની છે. ત્યાં તા. ૧૭ જાન્યુઆરી ૧૯૮૮ના રોજ પીર ગીગોશ મોહમ્મદ કા કુબા નામના સ્થળ પાસે પીલું કે ખારી જર (Salvadora persica)ના જાડ પર આ પક્ષી જોવા મળેલું. આ સ્થળ કચ્છના મોટા રણની કાંધી પર આવેલું છે. આ ઉપરાંત, મ. કુ. શ્રી હિમતસિંહજી, કવિ તેજ અને અશ્વિન પોમલે કચ્છના અભડાસા વિસ્તારમાં સિંધોડી ડિનારા પર ર માર્ચ ૧૯૮૮ના રોજ આ પક્ષી જોયેલું. (વિહંગ વર્ષ ૨૦૦૧, ગ્રીઝ, પાનુ ૧૨માં પ્રગટ થયેલી નોંધ મુજબ ડો. કેતન ટાટુએ બે મસ્કતી લટોરા પીલુરી પર કુંઘાર બેટ ખાતે જોયા હતા. -સ.)

મસ્કતી લટોરા, મુખ્યત્વે પીલુનાં ફળનો આધાર કરે છે. એ ઉપરાંત, તેમને સ્થાનિક રીતે 'ટેકારા'ના નામે ઓળખવામાં આવતા છોડના ફૂલની પાંખડીઓ અને ફળનો આધાર કરતા પણ જોવામાં આવ્યા છે. મસ્કતી લટોરા ક્યારેક એકલા, પણ મોટે ભાગે નાનકડાં જૂથમાં આધાર શોધતા દેખાય છે. આવાં ટોળામાં ૨૦ થી ૨૫ જેટલાં પક્ષી હોઈ શકે છે. મસ્કતી લટોરા સામાન્ય રીતે જાડના અંદરના ભાગમાં, પણ ક્યારેક ટોચની ડાળીઓ પર પણ આધાર કરતા દેખાય છે. એમને એ સમયે જોઈને પીલુ ખાતાં બુલબુલ યાદ આવી જાય.

જૂથમાં આધાર શોધતી વખતે એમનો 'પિયુ પિયુ' એવો બે સ્વરવાળો મીઠો અવાજ સાંભળવા મળે છે. એવું જોવા મળ્યું છે કે, એમની વિદ્યાયનો સમય નાંદક આવે છે ત્યારે, એટલે કે માર્ચ અને એપ્રિલમાં આ પંખી વધુ વાચાળ બની જાય છે. મસ્કતી લટોરાની રાતવાસાની જગ્યા દર વર્ષ બદલાતી જોવા મળે છે. ૨૦૦૪ સુધી તે દેશી ભાવળ

(*Acacia nilotica*) અને પીલુની મિશ્ર જાડીમાં રાતવાસો કરતા જોવા મળતા. ત્યાર બાદ, તે વિદેશી ગાંડા ભાવળના જાડ પર રાતવાસો કરતા દેખાયા છે. ૨૦૦૫ થી ૨૦૦૭ દરમ્યાન મસ્કતી લટોરા ગાંડા ભાવળ અને પીલુની મિશ્ર જાડીમાં રાતવાસો કરતા હતા. આ સમયગાળમાં ફૂલાય નાંદકની કાંટના ૨૦ હેક્ટર જેટલા વિસ્તારમાં મસ્કતી લટોરાના કુલ ત્રણ રાત્રિ રહેઠાણો જોવા મળેલાં.

મસ્કતી લટોરાનો રાતવાસાનો સમય જૈવિક ઘડિયાળનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સૂર્યસ્તની બરાબર ૩૦ મિનિટ પહેલા તેઓ રાતવાસા માટે એકઢા થતા. શયન પહેલા તેઓ આધાર, પોછાની સફાઈ (preening) અને બોલવાની (calling) પ્રવૃત્તિ કરતા. સૂવા માટે મસ્કતી લટોરા જાડની અંદરની બાજુની ડાળીઓ પસંદ કરે છે. સવારે ૭ થી ૭-૩૦ વચ્ચે મસ્કતી લટોરા રાતવાસો ત્યજે છે. પીલુનાં પાન ચરતાં ઊંઠે દ્વારા આ પક્ષી રાત્રિનિવાસ દરમ્યાન ખલેલ પામતું હોવાનું પણ જોવા મળ્યું છે.

મસ્કતી લટોરાના આવાસ સામે સૌથી મોટો ભય કોલસો બનાવવાની પ્રવૃત્તિ છે. અત્યારે કોલસો બનાવવાની રાજ્ય સરકારે છૂટ આપવાથી, સ્થાનિક લોકો ઉપરાંત રાજ્ય બહારનાં લોકો પણ આ કામમાં જોડાયા છે અને દુભાગ્યે આ પ્રવૃત્તિ માત્ર ગાંડા ભાવળ પૂરતી જ મર્યાદિત નથી રહી. પીલુ સહિત તમામ વૃક્ષો એનો ભોગ બની રહ્યા છે, જેના કારણે મસ્કતી લટોરાનું નિવસનતંત્ર (habitat) ત્વરાથી નાચ થઈ રહ્યું છે. કહેવાની જરૂર નથી કે, તમામ પક્ષીઓ પર આનો દુષ્પ્રભાવ પડવાનો. ખાસ કરીને ફ્લાહારી (frugivorous) પક્ષીઓના આધારની આનાથી અતિશય તંગી ઊભી થશે. ચારકોલ (કોલસો) બનાવવા માટે વૃક્ષના માત્ર ભાવું ભાગોનો ઉપયોગ નથી થતો, પરંતુ 'બુલડોગ' અને 'જેસીબી' મશીનનો ઉપયોગ કરીને જાડીઓને મૂળથી નાચ કરી દેવામાં આવે છે. આવાં મશીનો ઉપલબ્ધ ન હોય ત્યાં લોંડના મજબૂત તારનો ઉપયોગ કરીને ટ્રેકટર અને ટેમ્પા વડે વૃક્ષોને મૂળમાંથી જ ઉભેડવામાં આવે છે. જો આમ જ ચાલ્યા કર્યું તો મસ્કતી લટોરાનો આવાસ સપૂર્ણ રીતે નાચ થઈ જશે. છેલ્લાં બે વર્ષથી બેદામ રીતે ચાલતા આ ઉઘોગના કારણે કચ્છના પર્યાવરણને અતિશય નુકસાન થયું છે.

(નોંધ : મસ્કતી લટોરાના અભ્યાસમાં મદદ કરવા માટે ફૂલાય ગામના પક્ષીરસિક શ્રી મોહમ્મદ સાઈદાદુ તથા તેનમાર્કના શ્રી ઉફી સોરેન્સન (Uffe Sorenson)નો હું આભારી છું.)

પો. મોરી વિરાણી, નખગાંધા, જિ. કર્ણ, ૩૭૦૬૬૫



મ. કુ. હિંમતક્ષિહજણી કલમે


અગાઉ જ્યારે આપણા ઋષિ-મુનિઓની વાતોનું અથવા રામાયણ મહાભારત જેવાં ધર્મગ્રંથોનું અધ્યયન કરતા તારે અસ્ત્રો શસ્ત્રો, યાનો ઈત્યાદિનો ઉલ્લેખ તાર્ડિક યા કાલ્યનિક લાગતો. વિજ્ઞાનનો ઉલ્લેખ ફક્ત કરવા પૂરતો કરવામાં આવ્યો હશે તેવું લાગતું. હું ધારું છું કે, જર્મન સાક્ષરો અને વિજ્ઞાનીઓએ ભારતનાં પુરાતન લખાણોનું જેટલું અધ્યયન કર્યું છે તેટલું બીજા વિદેશીઓએ નહીં કર્યું હોય. પરંતુ સને ૧૯૮૪-૪૪થી પહેલા જર્મની અને ત્યાર બાદ અમેરિકા અને રચિયાએ આજ્ઞપર્યત વિજ્ઞાનક્ષેત્રે જે પ્રગતિ સાધી છે તે પ્રત્યક્ષ રીતે જોતાં એવો અહેસાસ જરૂર થાય છે કે ભારતીય લખાણોમાં બધી બાબતો કાલ્યનિક નહીં હોય. છેલ્લે જે પ્રલયનો ઉલ્લેખ છે તે આજની પર્યાવરણવિરોધી ગતિવિધિઓ જોતાં તેની સાથે મહદૂર અંશો મળતો આવે છે. અમેરિકા જેવા એક મોટા વિકસિત દેશને 'ગ્રીનહાઉસ ઇફ્ફેક્ટ' જેવા ગંભીર ખતરાની ચિંતા નથી તો ભારત જેવા દેશોની શી વાત કરવી? આજે મનુષ્ય દ્વારા જે કંઈ થઈ રહ્યું છે તે કુદરતની પ્રક્રિયા અને તેના નિયમોની વિરુદ્ધ છે તે તો સહુ કોઈ સ્વીકારશે. તેના પરિણામ અવશ્ય માટાં હશે.

હું કોઈ ભારતીય વિજ્ઞાન કે તત્ત્વજ્ઞાન ઉપર નથી લખી રહ્યો. મેં જે ઉપરોક્ત રજુઆત કરી છે તે, હું જે લખવા માગું છું તેની પૂર્વભૂમિકા છે. આજની આપણી નીતિઓ, ગતિવિધિઓ એ બધું આપણને એક આધુનિક પ્રલય તરફ ઝડપબેર લઈ જતી હોય તેવું ચોક્કસપણે સ્વીકારણું પડશે. જે રોપવી ન જોઈએ તેવી જાડી આપણે રોપી રહ્યો છીએ. જે ખરી રીતે ઉપયોગી નીવડે, જે પર્યાવરણની સાચવણી માટે જરૂરી છે, તેવી વનસ્પતિનો આપણો સંદર્ભ નાશ કરી રહ્યો છીએ. હાલ કંચ્ચમાં જે બન્યું અને હજુ બની રહ્યું છે તેનો દાખલો આપું. સરકાર પાસે એ રજુઆત થઈ કે ગાંડો બાવળ (*Prosopis juliflora*) ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તળપદી (*indigo-enous*) વનસ્પતિને વિસ્થાપિત કરી રહ્યો છે. આ ફરિયાદની નોંધ લઈ રાજ્ય સરકારે કોઈ વ્યવસ્થિત લોકો યા સંસ્થાને એ કાર્ય સોંપવાને બદલે લોકો પરથી પરદેશી બાવળનો નાશ કરવાનો પ્રતિબંધ ઉઠાવી લીધો. આનું એ પરિણામ આવ્યું છે કે, કોલસા બનાવવા માટે જે જાડી સાફ કરવાની હતી તેના બદલે તળપદી ઉપયોગી વનસ્પતિનો સરિયામ નાશ કરાયો. 'જે.સી.બી.' જેવાં

મશીનો ચલાવી ખેર, દેશી બાવળ, ગોરડ અને પીલુ જેવી જાડીનો ઉખેડીને નાશ કર્યો. આવી રીતે, અંગત આર્થિક ફાયદા માટે કંઈ જેવા સૂકા મુલકમાં, જેને ઊગતાં દાયકાઓ લાગે તેવી તળપદી વનસ્પતિનું નિકંદન કાઢવાનો ગુનો બનતો જોવામાં આવે તેથી દેખીતી રીતે અત્યંત ખેદ થાય.

પર્યાવરણમાં વિપરીત અસરને લીધે આવતાં પરિણામો જેવાં કે ઉષ્ણતામાનમાં વધારો, વાવાઝોડા, કમોસમી વરસાદ વગેરેનો આપણને આજે પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો છે. સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતમાં લીમાળા જાડ પર આવતાં ફૂલ આજે જુલાઈના અંતમાં જોવા મળે છે. કંઈમાં ઊગતા *Tamarix* (જેને અમે 'લઈ' કહીએ છીએ) પર સાફેભર મહિનામાં સામાન્ય રીતે ગુલાબી ફૂલ ઊગે છે, તે આજે પૂરબહારમાં છે.

ગુજરાતના ઘણા ભાગોમાં ભૂગર્ભનાં પાણીનું સ્તર નીચે ઉત્તરનું જાય છે ત્યાં આડેખડ કોઈ પણ નિયંત્રણ વિના પાતાળકુવા ખોદાઈ રહ્યો છે. વળી તેમને પ્રતિવર્ષે વધુ ને વધુ ઊંડા કરવામાં આવે છે. બીજી તરફ નર્મદાનું નીર નિયમિત મળતું ન હોવાથી નગરપાલિકાઓ ભુજ જેવા શહેરના ઉપયોગ માટે પાણીના નવા બોર ચાલુ કરતી રહી છે. બે ત્રણ એવા ઝોતોમાં પાણી ખાલી થઈ જાય એટલે તેના બદલામાં જે કંઈ પાણી હવે ભૂગર્ભમાં બચ્યું છે તેનો છૂટી ઉપયોગ થઈ રહ્યો છે. જો ભૂમિમાં બેજ ન રહેતો વનસ્પતિ જેનો તે ટકી રહેવાનો મુખ્ય આધાર છે, તેનું શું થાય? જાડાના સૂક્ષ્માયતો તો તેમાં આશ્રય લેતાં પંખીઓની શી વલે થાય એ વિચાર જ શરીરમાં કમકમાટી પેદા કરે છે! આ બધી ચાલુ રહેતી પ્રક્રિયા આધુનિક પ્રલય માટેના નોતરા સમાન નથી? મારા અને લવભાઈ જેવા જૂના જોગીઓ સુદ્ધિયાણી વાતો કરતા રહીએ, નિબંધો લખતા રહીએ અને એ રીતે હદ્દયની વેદના ઠાલવા સિવાય બીજું શું કરી શકીએ? સારાયે વિશ્વાના સત્તર પર પર્યાવરણવાદીઓ ઊંચે સ્વરે ચેતવણીઓ દેતા હોવા છતાં પહાડો પરનો, ઉત્તર અને દક્ષિણ શું પરનો બરફ પીગળવા માંડ્યો છે, જેની વિપરીત અસરો ત્યાં રહેતાં પંખીઓ સહિત તમામ જીવસૃષ્ટિ ભોગવી રહી છે. બરફીલા મુલકમાં પર્યાવરણવીય ફેરફારો થાય તેની સીધી અસર ત્યાંની જીવસૃષ્ટિ સુધી



પહોંચવામાં વાર લાગતી નથી; પરંતુ કાળકમે જેમ બરફ ઓગળવાનું પ્રમાણ વધશે તેમ નદીઓ પર વધારે અસર જોવા અને અનુભવવા મળશે. એ તો એક સાંકળ જેવી (chain reaction) પ્રક્રિયા છે.


હાલ કષ્ટમાં તીડનું આકમણ થવાનો પૂરો સંભવ છે. જો તીડ આવી પડે તો તેને ખાનારા કાગડા, સમડી હૃત્યાદિની સંખ્યા એટલી ઘટી ગઈ છે કે એ આકમણનો સામનો કરવામાં મુશ્કેલી ઊભી થશે. તેની સાથે સરકારી તંત્રો પાસે એક બીજો ખાતરીરૂપ ઉપાય તો હોય છે જ અને તે છે ક્રિટનાશક જેરી દવા. તેનો વ્યાપક પ્રમાણમાં છંટકાવ કરવાથી આપણી જીવસુસ્થિને પારાવાર નુકસાન થશે. આ પ્રકારના નુકસાનમાંથી બેઠા થવા માટે સમય નીકળી જાય તે સ્વાભાવિક છે. પરંતુ એક ઉપર બીજો ધક્કો વાગ્યા કરે તો તેમાંથી બહાર નીકળનું મુશ્કેલ છે. મનુષ્યોના હિત બચાવવા જતાં જીવસુસ્થિને કેટલે અંશે નુકસાન પહોંચ્યો શકે તેનું દાખાંત મેળે જોયું - અનુભવ્યું છે.

સને ૧૯૭૭માં સીમા સુરક્ષા દળ (B.S.F.)ના તે સમયના 'ઉચ્ચિટી કમાન્ડન્ટ' મેજર કૂપાનિધિ પક્ષીપ્રેમી હતા. તેઓ અમારી કષ્ટની 'પેલિકન નેચર કલબ' જોડે સારો ધરોબો રાખતા. અનેક વાર નિરીક્ષણ કરવા અમારી સાથે ચાલતા. તેમને સમાચાર મધ્યા કે હંજની મોટી સંખ્યા, હંજબેટ (Flamingo city)ની પદ્ધિત દિશામાં રણમાં છે. તે પરથી અમે તેમની સાથે ઊંઠો પર ચડી તા. ૨૭મી સપ્ટેમ્બર ૧૯૭૭ના રોજ રણમાં ગયા. તે વર્ષે ભારે વરસાદ થયો હોવાથી મોટું રણ એક વિશાળ સમુદ્ર જેવું ભાસતું હતું. અમે જેવા તેના ડિનારે પહોંચ્યા કે થોડો આરામ કરવા ઊંઠો પરથી ઊત્થા. જે દશ્ય મેં ત્યાં જોયું તે હું ભૂલ્લી શકતો નથી. મારી સાથે તે ડિવસે અમારી કલબના સેકેટરી શાંતિલાલ વર્ઝ (આજે પણ તેઓ તે જ હોદા પર છે) અને નવીન બાપટ સહિત બીજા સહ્યો પણ હતા. ત્યાં સખત પવન ફૂકાવાની સાથે ડિનારા પર મોજાં આવતા હતા તેથી તથાઈને અમુક તીડો અને માછલીઓ સાથે અસંખ્ય મૃત જીવંતું પથરાયેલાં જોયાં. આ અગાઉ રણની કાંધીએ આવેલ કાળા કુંગર પર તીડોનું આકમણ થયેલું જેના ઉપર જિલ્લાના તંત્ર દ્વારા ક્રિટનાશક દવાનો છંટકાવ થયેલો. ત્યાર બાદ અમુક દિવસો પછી ભારે વરસાદ થતાં કાળા કુંગર પરથી એ જેરવાનું પાણી રણમાં પ્રવેશ્યું જેની વ્યાપક

પ્રમાણમાં મારી અસર થઈ. રાખેતા મુજબ હંજ તેમના ઈડાં મુકવા અને બચ્યાં ઉછેરવા ત્યાં એકઠાં થયાં પરંતુ તેમનો સૂક્ષ્મ જીવોવાળો આહાર નાચ થયો હોવાથી તેઓ ત્યાંથી પદ્ધિત તરફ ગયા જ્યાં બી.એસ.એફ.ના જવાનોએ તેમને જોયાં હતો. પણ અમે ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં ત્યાંથી પણ ઉડી ગયાં હતાં. અમને ડિનારા પર છોડી શ્રી કૂપાનિધિ અને શ્રી નવીન બાપટ એક ઊંટ પર દૂર સુધી શોધ કરવા રણમાં ગયા, પરંતુ તેમને એક પણ હંજ જોવા ન મળ્યું! ત્યાર બાદ બે ત્રણ વરસ સુધી હંજનું પ્રજનન કષ્ટના મોટા રણમાં થયું ન હતું. ઉપરોક્ત દાયાતથી 'વિહંગ'ના વાયકોને ખ્યાલ આવશે કે એક જીવને મારવા જતાં બીજાં અસંખ્ય જીવોને કેટલે અંશે નુકસાન થઈ શકે અને તેની બીજી જે આડઅસરો થાય તે કેટલી વ્યાપક હોઈ શકે.

આપણો ત્યાં વરસાદ આધારિત ભેતીમાં રાસાયણિક તત્ત્વનો વપરાશ પ્રમાણમાં ઓછો છે, પરંતુ પીયત ભેતીમાં તેનો વિપુલ પ્રમાણમાં વપરાશ થતો રહ્યો છે. હંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરે વર્ષોથી વપરાતાં રખ્યાં છે. વાયકીઓમાં અને પીયત જીમીનમાં શેડા પર રહેતાં પ્રાણીઓની સંખ્યા ઘડી ઘટી ગઈ છે. વગડાઉ બડકિયું (Rock Bush Quail) પીળાપગ બિલ બટેર (Button Quail)ની જાતો ઉપરાંત (Star Tortoise), સેરવા (Hedgehog) જેવાં પ્રાણીઓની સંખ્યામાં આજે દેખીતી રીતે ઘટાડો થતો રહ્યો છે. તેના મૂળમાં રસાયણોની અસર ચોક્કસ રીતે છે. આવા પ્રાણીઓના લોહી કે પેટના ખોરાકનું પૃથક્કરણ કરવાની પ્રક્રિયા આપણા દેશમાં નહિયત છે. જો તે નમૂનાઓ તપાસાય તો મને ખાતરી છે કે, ઘણી ચોકાવનારી વિગતો મળી રહે. એ સિવાય ઉદ્ઘોગો દ્વારા ફેલાતા પ્રદૂષણની માત્રા પણ ચિંતાજનક છે. વીજાઉત્પાદન માટે અશુશ્વકિતનો વ્યાપ વધારવામાં પણ જોખમ છે. ચેનોબિલ કે ભોપાલ ગેસ કંડ જેવી કોઈ ઘટના અશુશ્વકિતના ભંડારમાં બને તો તેનો વિચાર માત્ર આપણને પ્રુજાવી નાખશે! આમ વિદ્યુત ઉત્પાદન અને બીજા દેશોપયોગી કાર્યોના બીજા વિકલ્પો જેવાં કે પવનશક્તિના, સમુદ્રના ભરતી અને ઓટનો ઉપયોગ હિત્યાદિનો વપરાશ શા માટે ન વધારી શકાય? જ્યારે ખુદ મનુષ્ય પર તોળાતા ખતરાની પરવાહ થતી નથી તો બિચારા પંખીઓનું શું ગરું છે?

જ્યુબીલી ગ્રાઉન્ડ, ભુજ ૩૭૦૦૦૧



ફોટો : નવેન પેરિયા

ચોમાસામાં વરસાદનાં પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાય છે અને વિશાળ જળવિસ્તારોનું સર્જન થાય છે. શિયાળામાં જ્યારે હિમાલયની ઉત્તરે એશિયા અને યુરોપનાં પ્રદેશો ઠંડીની ભીસમાં આવી જાય છે અને પાણી થીજી જાય છે ત્યારે મોટી સંખ્યામાં પાણીનાં પક્ષીઓ દક્ષિણ તરફ પ્રયાણ આદરે છે. ભારતનાં અને ખાસ કરીને ગુજરાતનાં જળાશયો આ પક્ષીઓ માટે સ્વર્ગસમાન પૂરવાર થાય છે.

- લવકુમાર ખાચર

VIHANG (Quarterly) Jan. - Mar. 2008
RNI No. GUJGUJ/2007/20874 Dt. 21-8-07



કાપાડી (Black-shouldered Kite)

નિર્માણ :: અંગેજ પોલીટિક્સ



An Exquisite Jewelry Mall from



ARVIND BHAI
JEWELLERS

Satellite, Ahmedabad

a benchmark of
Quality, Purity & Trust!

Exclusive Showrooms across 3 floors ...

Carats & Cents

Real Diamond Jewelry

Golden Attire

Gold & Antique Ornaments

Silver Ornates

Silver articles & Fashion Jewe